

શ્રી યતોપિજયણ
દેન ગંથમાળા

દાદાશહેલ, ભાવનગર.

ફોન : ૦૨૯૬-૨૪૨૫૨૨૨

૩૦૦૮૮૫૫

વિવર નથ સુંદરકૃત.)

ઐતિહાસિક.

શ્રી ગિરનાર તીર્થોધ્યાર રાસ.
અને

તીર્થ માળા.

દક્ષિણ વિહારી સુનિ શ્રી બાલવિજયણ
ભાડારાજનાં ઉપદેશથી.

પ્રસિદ્ધ કાર્તી,

સાહિત્ય સેવા સમાજના, એચ. સેહેટથી,
શા. બ્રજલાલ ઉજમથી.

પારણેટ, - ભાવનગર.

પાલીતાણ ધી "બાહુરસિહણ પ્રિન્ટિંગ-પ્રેસમાં
શા. અમરચંદ ઘુણેયરદાસે છાપ્યો.

મુનિ શ્રી બાલચિન્યજીના સહૃપદેશથી ચાલતી,
સાહીત્ય સેવા સમાજ તરફથી અગાઉ થતાં
પુસ્તકો.

- ૧ સચિવ મહિલા મહોદય બીજુ આવુંચિ.
- ૨ જૈબાય્ય સુંદરી નોવેલ પૂર્બ ૩૦૦ છપાય છે.
- ૩ માનવ મહોદય અંથ હિન્દિમાં લખાય છે.
- ૪ અજીતસેન કનકાવતિ નોવેલ પ્રેસમાં છે.
- ૫ વિકમસેન લીલાવતિ નોવેલ.
- ૬ પ્રકાયર્ય સંરક્ષણુ
- ૭ મનુષ્ય માત્રનો સામાન્ય ધર્મ.
- ૮ ગિરનાર તીર્થીદ્વાર રાસ સાર્થ.
- ૯ શ્રી કેશરીઅણુનો રાસ સાર્થ.

ઉપરના અંથો કેટલાક પ્રેસમાં છે, કેટલાક લખાય છે, કેટલાક આહીર પડવાની તૈયારીમાં છે.

મળવાણુ { ૧૦ }

શા અમરચંદ બહેચરદાસ.
નૈન પુકસેલર—પાંડીતાણુ.



સાહિત્ય સેવાસમાજ અંથમાલા પુન્ને ૨ નં.

શ્રી ગિરિનાર તીર્થોદ્ધાર

નાના રામ. નાના

પૂજય મુનિમહારાજશ્રી બાળવિજયલુની ગ્રેરણ્ણાથી

સંરોધક અને સંપાદક,

મોહનલાલ દલીથંડ દેશાધી,

ધી. એ. એલ. એલ. ધી.

વકીલ હાઈ કોર્ટ પ્રિન્સેસ સ્ટ્રીટ—મુંબઈ.

કલોધિ વાદા રોડ શીખદાસ લેંકડ
તરફથી ભેટ.

સને ૧૯૨૦

પ્રતિ ૨૦૦૦.

સં. ૧૯૭૬

શાલુ પ્રીણ્ટિંગ પ્રેસ—પાદીતાણા.

મુનિ ખાલવિજયળના સહુપદેશથી શ્રી ગિરિનાર
 તીર્થોદ્ધાર રાસ છપાવવા માટે અગાઉથી થનાર
 આહકેનાં મુખારક નામ.

નામ.

ગામ,

શા. શજલાલ ઉજમશી કાપડીયા	ભાવનગર.
શા. હરખચંદ ઉજમશી	બુનાગઠ.
શા. દામોદર હરખચંદ	વડાલ.
શા. કપુરચંદ અમરશી	બેસાણ રાણપુર.
શા. અગુભાઈ ચુનીલાલ	અમદાવાદ.
શા. લદ્દિલભાઈ ગુલાખચંદ	વડાલી.
શા. અમીલાલ હરીદાસ	એઠન ફેર્ન્પ.
શા. જમનાદાસ મનોરદાસ	માંગરોલખબંદર
એન મણી માવળ	રાણુલાખબંદર.
આવિદ્રા ઉજમણેન	સુજપુર.
શા. હઠીસંગ ગગાભાઈ	કેંઠ.
શા. નેમચંદ ગોવિંદજી	પ્રદ્રાસનપાટણુ.

આ પુસ્તકનો સર્વ હૃદ સાહિત્ય સેવાસમાને રાખેલ છે.

નિવેદન.

કવિવર નપસુનંદર એક નામી જેન કવિ વિહૃમ સંવત્ની સત્તરમી સહીના પૂર્વાધમાં થઈ ગયેલા છે, અને તેનું છુવન વિસ્તારથી આનંદ ક્રાંત્ય મહોદધિ માણિક દામાં માર્ગ લખેલું પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. તે જેહ જવા વાચકને વિનતિ છે. તેની આનંદ તેમની ઉપલખ કૃતિઓને નિર્દેશ કરેલો છે, પરંતુ આ કૃતિ તે લખવાના સમયે ઉપલખ થઈ શકી ન હતી તેથી તેનો નામનિર્દેશ પણ થઈ શક્યો નહોંતો. હુમણાં સુનિ મહારાજશી ખાતાવિજયલુંએ આ કૃતિની હુસ્તાતિભિત પ્રતિ તથા તેની કરેલી પ્રેસમાં મોકલવા માટેની નકલ મારા તરફ મોકલી આપી અને તેથી એક વિશેષ કૃતિ આપડી, તે વાતથી અનમાં આનંદ થયો.

તે સુનિશ્ચીની આજાથી તે પ્રેસ કોપી એક પ્રતપરથી કરાયેલી હોવાથી અશુદ્ધ હતી, તેથી નવીનજ પ્રેસ કોપી મેં તૈયાર કરી છે, અને આ પ્રસ્તાવના લખી છે. આ તક આપવા માટે તે સુનિશ્ચીનો ઉપકાર માતું છું.

આ ગિરિનાર તીર્થોદ્બાર સંખાંધી નાનો રાસ કવિએ દધિગામ એટલે દધિસ્થલિ-હાલની દેથલી એ ગામમાં રચેલો છે, કે જે ગામ સિદ્ધપુર પાસે આવેલું છે, અને જે પરમાર્હત કુમારપાળ નરેચની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. આ રાસપરથી એ સિદ્ધ થાય છે કે, કવિએ સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનાર તીર્થની યાત્રા કરી છે. આવોજ કુંકો રાસ કવિએ સૌરાષ્ટ્રમાં આવેલા મહૃતીર્થ નામે શાંકુંજય સંખાંધી પણ રચ્યો છે, કે જે સુપ્રસિદ્ધ છે. અને તે ઉપરોક્ત માણિકમાં પણ પ્રકટ કરવામાં આયો છે. ને તેની રચ્યા ખાત સંવત् ૧૯૨૮ આસો શુદ્ધ ૧૩ મંગળવાર છે. ગિરિનાર

સંખ્યાધીનો રાસ ક્યા વર્ષમાં રચવામાં આવ્યો, તેનો ઉલ્લેખ કવિઓ કરેલો નથી, તેથી કવિની કૃતિઓ જ્યારે સં. ૧૬૨૮ થી સં. ૧૬૬૬ સુધીની મળી શકી છે, તો તે દરમ્યાન તે રાસ રચાયેલો હોય એ સંભવિત છે.

સાર.

જેના ચરણુકમલમાં સર્વ ઈદ્ર શિર ઝૂકાવે છે, એવા ચાવીશ જિનવરને પ્રણામ કરી, તે પૈકીના ખાપીસમા જિનવર શ્રી નમિનાથ શીલરત્નલંડારના પદપંકજ જ્યાં વિરાજે છે, એવા ગાઢ ગિરિનારનો મહિમા કવિ ગુરુની આજા લઈ કિંચિતું વર્ણુવે છે.

કાશમીરના નવહુલ નામના નગરમાં નવહુંસ નામનો રાજ હતો, અને તેને વિજયાદે નામની રાણી હતી. ત્યાં ચંદ્રશેઠ વસતો હતો, કે જેને ત્રણુ પુત્ર નામે રત્ન, અદન અને પૂર્ણસિંહ હતા. આમાંના જયેષ્ઠ પુત્ર રત્નને મહિની નામની કી હતી, અને તેણીથી કેમલ નામનો પુત્ર થયો હતો. આ રત્નશેઠના સંમય સંખ્યાધી અથમાં એવો પાઠ છે કે, નેમિનાથના નિર્વાચું થયાને આઠ સહાય વર્ષે તે શોઠ થયા. (જુઓ ચતુર્વિશત્તિપ્રથંધ-રત્નશેઠ સંખ્યાધી ત્યાં ઉલ્લેખ છે.)

એક સમયે વનમાં એક જાની મહિમાનિ પદ્ધાર્યા. તેને વાંદવા રાજ, રત્નશેઠ વગેરે સર્વ ગયા. તે વખતે તેમણે દેશના આપતાં જિનપૂજાનો અધિકાર લઈ તેથી થતા લાલ ખતાવી, તથા તે નિમિત્તે તીર્થ નામે શત્રુંઘ્ય અને ગિરિનારનો ઉલ્લેખ કરી ગિરિનાર અંખધી વિશેષ મહિમા હાપણ્યો કે:- “ ગિરિનાર લીર્થમાં નેમિનાથના ત્રણુ કલ્યાણુક (કલ્યાણ હિવસે નામે નિષ્કુમણુ-દીક્ષા, કેવલજીન, અને નિર્વાચુ-અપ ત્રણુ) થમેલ હોવાધી તેનો સહિમા અપાર છે. પરધમીદિ પ્રબ્રહ્મસુરાણુમાં પણ આ

રૈવતાદ્રિ—ગિરિનારતુ માહાત્મ્ય વર્ણવેલું છે. (તેના રલોકે પણ ટાંક્યા છે.) હું વેા રૈવતગિરિ અને તે પરની નેમીખરની ભૂત્તિની ઉત્પત્તિ અર્થપદાધપરથી કવિ ઉક્ત મુનિના મુખમાં ભૂકે છે કે:—

“ અતીવ ચૈપવીશી (ચોલીશ લીંફર) પેડી બીજા સ્તાગર સ્વામીને ઉનેણી રાજા નરવાહુને એવો પ્રશ્ન કર્યો કે, ‘ મારી સુક્તિ ક્ષયારે થશે ના ? ’ આના ઉત્તરમાં જિનવરે જણાયું કે, આગામી (આવતી) ચોલીશીમાં નેમિ જિનતા સમયમાં થશે. આથી તે રાજાએ દીક્ષા દીધી, અને અંતે પાંચમા કદ્દપનો પતિ-હૈવતા થયો. (૩) તેણે અવધિસ્તાનથી નેમિનાથનું બિંબ વજ્ઞમય મારીયું બનાયું, કે જેણી હશ આગરોપમ સમય સુધી ઇદ્રોએ પૂજા કરી, પછી પોતાનું આયુષ્ય કુંડં જણી તેણે તે પ્રતિમા રૈવતગિરિ કે જ્યાં નેમિનાથનાં જણુ ક્ષયાળું થયાં છે ત્યાં આણી એક શુક્કામાં મતોહર ચૈત્ય ઘનાવી તેના ગર્લગૃહમાં સુવર્ણુ, રતન અને મણિની એમ પણ સુર્તિ સ્થાપિત કરી, અને તે આખા ચૈત્ય-બાવતનું (શિખરનું ?) નામ ‘ કંચનબલાનક ’ આપી તેમાં ઉપરોક્ત વજ્ઞમુનિકામય સુર્તિ સ્થાપી. પછી તે દ્વેષ નેમિનાથના સમયમાંજ પુરૂષસાર નામનો રાજ થયો કે કે પોતાનો પૂર્વલખ નેમિ સુખેઠીજ જણી ગિરિનાર આયો. પોતાના પૂર્વલખમાં પોતાને છાથેજ ઘનાવેલ જિનપ્રતિમા પૂજુ, પોતાના પુત્રને રાજ સોંપી, પછી નેમિ પાસેજ દીક્ષા દીધી. આ પ્રમાણે રૈવત તીર્થની ઉત્પત્તિ પૂર્વ પુરુષેણે જણાવી છે, અને જેવીજ હીતે શાત્રુંજય માહાત્મ્ય નામના અંથમાં દાખલેલ છે. (૧) ભરતાદિકે વિમલગિરિ-શાત્રુંજયના ઉદ્ધાર કરાયા તે વખતે રૈવતગિરિના પણ ઉદ્ધાર કરાયા છે. (૨) જ્યારે પાંડવેણે ઉદ્ધાર કરાયો, ત્યારે તેમણે ઉત્તમ પ્રાસાદ અંધાવી સેમાં વેખામય પ્રલુની ભૂત્તિ સ્થાપી, એવો અધિકાર આવે છે. આસ ગિરિનાર તીર્થનો મહિમા જણી એ કાવિ ખોડો ! નેમિ-

નાથની ત્વાં સેવા કરી અનંત સુખ મેળવો. ”—આ પ્રમાણે દેશના પૂરી થધ.

આ સાંભળી રતન આવકે હુંઠિત થઈ સભાની મધ્યમાં એવો અભિગ્રહ (નિયમ વિશેષ) લીધો હે, જ્યાં સુધી સંધ લધ ગિરિનાર નેમિજિનને લેટું નહિ ત્વાં સુધી મારે ચાંજથી પાંચ વિકૃતિ (વિગ્ય) નો ત્યાગ છે, ભૂમિપર શસ્ત્રન, ઘ્રણચર્યનું સેવન, અને એક વખત આહુારતું થફણું છે.

સંધ લધ જવાનું સુહૂર્તી લઈ કંકોની સર્વત્ર મોકલાવી અસ્થ, ગળ, રથ અને સૈન્ય લઈ વાજતેગાજતે સંધ લઈ, રતન આવકે પ્રયાણ કર્યે. સંધ સાથે કેડાધિપતિ વિષુકો, અને દેરા-અરો, ગંધવો, આટ, ચર્મતળાવ એટલે પાણીની મસ્કો વગેરે સર્વ લઈ, શુરૂ સહિત માર્ગે ચાલતાં ચાલતાં દૈલાતોલા ગિરિ કુશલક્ષેમ તે આવી પહોંચ્યો. એવામાં એવું ખન્યું હે, એક વિકાલ કુરૂપી પ્રેત અતિશયામ ઇપનો,—અર્ધ મનુષ્ય અને અર્ધસિદ્ધ-ના ઢેહુંચાણો આવી; જર્વ લોકને ભીવરાવવા લાગ્યો, અને મારી સરત પાછ્યા વગર ને કોઈ એક ડગ પણ ભરશે તો યમપુરિમાં પહોંચાડી દ્ધિશ એમ બોલવા લાગ્યો. સંધ ભયભીત ખન્યો. સરત જાણવા માંગી તો પ્રેતે જણાયું હે, ‘મને ને સંધમાંથી એક પ્રધાન પુરુષ આપો તો સંધને જવા હઉ. ’—આ વાતની રતન સંધપતિને અભર પડી હે તુરતજ તેણે જણાયું હે, ‘કોઈ પણ ક્રિકર કરતા ના હું આ સ્થાનકે રહી પ્રેતને મારું શરીર સોંપવા તૈયાર હું. તમે સૌ સંધ સુઝેથી જઈ નેમિ પ્રભુનાં દર્શન કરો. ’—આથી સંધના કેટલાક તે અરત પોતે બનનશે, એમ ઠણેવા લાગ્યા. રતનના નાના એ કાઈ મહન અને ખૂરણ પોતાને તે કાઈ સોંપવાનું વિનષ્વવા મેડયા, સતી સી પચિની વિલાપ કરી એ ઉપસર્જ પોતે સહુન ઠરણા તૈયાર છે એમ પુકારી ઠણેવા લાગી, ત્યારે પુત્ર ક્રોમલ પિતાને બદલે પોતે પ્રાણું અર્પશે એવું બોલ્યો.

આખરે શોઠ રત્ન, તેની પત્ની પદ્મિની અને સુત કોમત એ
ગ્રણે તે સંશોધન પાળવા અયે રહી, શેડે ગમે તેમ જીમનાવી સંધને
પાત્રા કરવા રવાના કર્યો.

પેઢો પ્રેત સંધપતિને મહાનાદ કરી ચીક ગુફામાં લઈ ગયો,
જ્યારે તેની ઓછી તથા પુત્રે કાયોતસર્ગ ધ્યાન ધર્યું, અને મનમાં
સંકદ્ય કર્યો કે, જ્યારે સંધપતિ આ કષ્ટથી છુટશે, ત્યારે અમે
અજપાન લઈશું. આવે જ્યે રૈવત પર્વતપર સાત ક્ષેત્રપાત્ર
આંબાદેવીને વાંદવા જતા હુતા, તેમણે આ ઉત્પાદ સાંભળ્યો. અને
આંબાદેવીને વિનિયાં કે આ શું છે ? - દેવીએ ધ્યાન ધરી નેતાં
લાશ્યું કે, હોછ મહાપુરુષને હોછ ફુલ ઉપદ્રવ કરે છે, એટલે
ચાતે ચાતે ક્ષેત્રપાળને સાથે લઈ પ્રેતના સ્થાનકે આવ્યાં. નારી અને
કુમારને ધ્યાનસ્થ નેઈ હિતમાં કુપાલાવ-ભક્તિભાવ જાગ્યો. પ્રેતને
કહું કે, હું નેમિ પાસે વસ્તું છું, અને આ મારો સહધર્મી છે
તેને સુધ્રા કર, અગર તો મારી સાથે ચુદ્ધ કર. બંને વર્ષે
ચુદ્ધ થશું. તેમાં પ્રેતને પોતાના પગ નીચે ધરી નાંખ્યો, અને
થણ્ણો અદ્દાજ્યો. આખરે તે પ્રેતે પોતાની માયા જાંવરી પોતે
અસતી હીંય કરુંચન કાય ધરી, વૈમાનિક હેવ તરીકે પ્રકટ થયો.
સંધવીપર પુણ્યવૃદ્ધિ કરી, તે છેવા લાગ્યો, : હે બ્યવહારી !
તને અને તારી ઓછી તથા પુત્રને ધન્ય છે. તે શુરૂઆતે ને નિયમ
લીધો હુતો, તે મરણુંતક કષ પડતાં છતાં પાજ્યો. તારા સાહસનું
પારખું લેવાજ મેં આ સર્વ કીધું હતું. ' પછી તે હેવતા
સુરસ્થોક સિધાવ્યો, આંબાદિક નિજસ્થાનકે ગયાં, અને સંધપતિએ
સંધ સાથે ગિરિનાર પર્વતપર જઈ નેમિનાથનાં દર્શન કર્યો.
મૂર્ત્તાનું સ્નાત્ર કરતાં વિસ્મયકારક વાત એ બની કે, લેપમય
બિંબ હતું તે ગળી ગયું. આથી રત્ન સંધવી જિજ્ઞ થયો,
અને પોતાની કંદક અશાતના થઈ હુશે તેથી તેમ બન્યું હશે,
એમ ગણી પોતાને ધિક્ક ગણુવા લાગ્યો. પછી તેણે બાધા લીધી

કે, જ્યાં સુધી તે બિંબને બદલે રતનું બિંબ ન સ્થાપું, ત્યાં સુધી જલ અજ લઈશ નહિં. સર્વ ચીજુ તછ ઉપવાસ કરી તપ કરવા માંડયું, અને સાઠ ઉપવાસ થયા તે આંબાજી માતા પ્રત્યક્ષ થયાં. તેણી રતનશ્રાવકને જ્યાં કુંચનખલાનક નામનો પ્રાસાદ હતો ત્યાં લઇ જઈ નેમિનાથના સમયમાંજ શ્રીકૃષ્ણ વિનિર્મિત પ્રધાન બિંબ તથા સુવર્ણ, રતન, રસું, મણિ શ્રીમ દરેકનાં અદાર મળી હું બિંબોનાં દર્શન કરાવ્યો. તેમાંથી કોઈ પણ લેવા માટે કહ્યું. રતને તો રતનું બિંબ લેવા વિચાર કરેંટ ત્યારે આંબાદેખીએ કહ્યું કે, આગળ કલિયુગ આવે છે, અને તે વખતના અતિ લોલી લોકો થતાં પ્રતિમાનું વિપરીત થાય, તેથી પણાણું બિંબ દ્વયો તો સારું. હું તે બિંબ કેમ વહુ જયું? ત્યારે આંબાદેખીએ કહ્યું કે, કાંચે તાંતણે બીઠી ચલાપણે તો એની મેળે ચાલી આવશે; પણ તેમ કરતાં પાછું ન જોવું, અને જોવું તો તરતજ તેજ સ્થાનકે સ્થાની થશે. આથી શ્યામ પણાણું બિંબ લીધું, અને તે વિસ્મયકારક સીતે એમનોએમ ચાલતાં ચાલતાં, આવે છે કે નહિં એમ વિમાસતાં રતને પાછું જોશું કે તુરતજ ત્યાં બિંબ સ્થિર થશું. ત્યાં અસાદ કરવી, તેમાં તે બિંબને પ્રતિક્રિત કર્યું. આજ લગ્ની તે સ્થયે તે બિંબ પૂલય છે.

સુધી ઘણો વળી શરૂંજય આવી ઋપન જિનેશ્વરને વાંદી પછી સ્વરસ્થાનકે ગયો. શૈતન આવકે અનેક દ્રવ્ય અચીરી સુકૃત કર્યું. આ પ્રમાણે હુકીકત લાલ્યું પ્રભાધમાં જણાવેલી છે. આ કુંચનખલાનક પ્રાસાદ તથા રતનશ્રાવકે સ્થાપિત કરેલ બિંબના સંબંધમાં ગિરિનાર કદ્વપમાં આ પ્રમાણે હુકીકત છે:—

જિરિના મધ્યમાં દુદ્રે વળખણે વિવર કરીને (પોઢો ભાગ કરીને) કાંચનખલાનકમય રજત જૈત્ય અનાંયું. તે જૈત્યના

મધ્યમાં શ્રી નેમિપ્રભુની રત્નમયી મૂર્તિ પ્રભુના દેહમાન અને વર્ષુ પ્રમાણે ઈદ્રે સ્થાપિત કરી, અને તે ઉપરાંત થીજાં ગ્રણ બિંબને ઈદ્રે હેવતાઓ પાસે તે ચૈત્યના મધ્યમાં અમ વસ્તુભૂમાં સ્થાપિત કરાયા. તે ગિરિના ચૈત્યમાં અવલોકનવાળા (ખુંલા) જિપરના રંગમંડપમાં અંધાની મૂર્તિ અને બલાનકમાં શાંખની મૂર્તિ છે. તેનીજ જેવું થીજું ચૈત્ય નેમિપ્રભુના નિર્બાધુસ્થાને પૂર્વ સન્મુખ ઈદ્રે નિર્માણ કર્યું હતું. ઈદ્રે કરેલા ચોખારા બલાનકમાં રહીને મેઘઘોટ હેવ પ્રભુનું અર્થેન કરતા હતા. નેમીશ્વર પ્રભુની લેપમયી પ્રતિમા એ હળાર વર્ષ સુધી (ટકી) રહી. તે લેપમય મૂર્તિનો નાશ થયે સતે અંધા હેવીના આદેશથી અને રેતન નામના આવકેન્યાં પાશ્ચયમ સામું (નવું) ચૈત્ય સ્થાપ્યું. કાંચન બલાનકની અંદરના સમવસ્તુભૂમાંથી રેતન આવકે કાચા સુતરના તાંત્રયા પડે જેંચીને આ (આજ કાળે વિધમાન) બિંબ અહીં આણ્યું.

ત્યાર પછી કલિકાલમાં જિનશાસન દીપક આવકો અનેક અયા છે, તે પૈકી શુર્જર રાજ સિદ્ધરાજ જ્યાસિંહનો પ્રધાન મંત્રી નામે સંજગને બાર વરખની સોરઠની બંધી કમાઈ ખર્ચી નાખી નેમિપ્રાસાદનો ઉદ્ઘાર કર્યો; રાજ સિદ્ધરાજે આખરે તે જોઇ મશાંસા કરી. (સરખાવો ગિરિનાર કદ્વનો ભાગ):— ‘યાકુડી અમાત્ય અને સંજગન દંદેશ પ્રમુખ અનેક ઉત્તમ જોનોએ નેમીશ્વર પ્રભુના ચૈત્યનો ઉદ્ઘાર કર્યો છે.

પછી થી વસ્તુપાદ અને તેજપાદ એ એ મંત્રીઓએ જૈન ધર્મને ઢીપાંયો. અને એવાં કાર્યો કર્યાં હો જે છાયે દર્શનવાળા ચોને બાબ્યાં. શરુંજયપર અઠાર કોડ અને બાલું લાખ, ગિરિનાર પર બાર કોડ અને એસી લાખ, આખું ઉપર લુલુગવસહી નામે પ્રાસાદ કરાવવાર્મા બાર હોડ ત્રેપન લાખ દ્રોય ખર્ચ્યાં, ૧૨૪ જિનપ્રાસાદ બંધાબ્યાં, ૨૩૦૦ લર્ણ પ્રાસાદનો ઉદ્ઘાર કર્યો,

૬૬૪ પૈષણશાળા (ઉપાશ્રય) બંધાંયાં, અને જૈન બંડારો માટે પુસ્તકો લખાવવામાં ૧૮ કોડ અર્થો. ૫૦૦ ચિહ્નાસન, ૫૦૦ જમોસરણુ (ના પણ) કરાયા, સવા લાખ બિંબ પ્રતિમાઓ કરાવી, ૨૧ ને સૂર્યિપદ અપાયા. ૬૨ વર્ષે બાર સ્વામી વાતસલ્ય (જમણુ) આપી ત્રણ વાર સંધ પૂજા કરી. આ સિવાય પરધર્માઓ વાસ્તે પણ અનેક કાર્યો કર્યો—જેવાં કે ૩૦૨ શિવાત્ય, ૭૦૦ ઘ્રણશાળા બંધાંયા. આપાલિકો માટે એટલા મઠ બંધાંયા કે જેમાં હુમેશાં એક હુણર જેગી જમતા, ૭૦૦ ઘર્મશાળાઓ કરી, હુણરો જ્ઞાન દાન કર્યું. ૭૦૫ વિદ્યામઠ; ૭૦૦ ઝ્રવાઓ બંધાંયા; ૪૬૪ વાવ, અને ઘ્રણપુરી કરી, ૮૪ સંરોવરો રૂર પદ્ધતરના કિલ્લાઓ બંધાંયા. શાનુંજયની બધી મળી ૧૨૫ યાત્રાઓ કરી. તેરમી વખતે બાત્રા કરતાં માર્ગમાં (વસ્તુપાલ) અદ્રગતિ પાભ્યા. જૈનથી અન્ય ધર્માઓ માટે પાગ અનેક કાર્યો કરી સમદિલ હાખવી પોતાની નામના વધારી, અને તે એટલે સુધી કે દક્ષિણામાં શ્રી પર્વત, પશ્ચિમમાં ગ્રલાસ પાટણુ, ઉત્તરમાં કૈદાર અને પૂર્વમાં વાણુઃશી (કાશી) સુધી કીર્તિ પ્રસરી, અંદેશાં સર્વ દ્રોયની સંખ્યા ત્રીસ કરોડ, ચૈંડ લાખ, અદાર કુલાર, આઠસો ને ત્રણ થાય છે. આ સર્વ અદાર વર્ષની અંદર અરવ્યું:

(સરખાવો ગિરિનાર કુદ્દ્ય—ગિરિનારની મેખલા—કંડોશાને સ્થાને તેજપાલ મંત્રીશરે ત્રણ કલ્યાણક સંબંધી ચૈત્ય કરાયું, અને વસ્તુપાળે તે ગિરિપર શાનુંજય, જમેતથિએ અને અણાપદ તીર્થોની રચના કરી.)

શ્રી રત્નાકર સૂરિના ઉપરેશથી શા પેથડશાહે બાણું જૈન વિહાર (જિન ગૃહ) બંધાંયા. સિદ્ધાચલ (શાનુંજય) માં આહિબુધનમાં એકવીશ ધટિકા સુવર્ણ આણ્યું, તેના સુત નામે ઝાંઝણે શ્રી શાનુંજયથી આવી ગિરિનાર પર સુવર્ણ ધવળ સહિત નોમપ્રાસાદ કરાયો. (સમરાંયો.)

શાહે વિક્રમ સંવત् ૧૪૪૬ માં રેવતાચલ (ગિરિનાર) પર
નેમિ પ્રાસાદનો ઉદ્ઘાર કર્યો.

આમ અનેક મહુાશાગ શાવકે થઈ ગયા કે જે મણે ગિરિ-
નાર તીર્થનો ઉદ્ઘાર કર્યો છે. ઉપરંધારમાં લેછાએ તો અત્યે
પ્રાચીન-પૈરાણિક ઉદ્ઘારે—૧ ભરતપદિકે, ૨ પાંડવોએ, ૩ ક-
દ્યુપતિ દેવતાએ અને ૪થી રત્ન શાવકે કરેલા ગણ્યાય. ત્યાર
પછી ગણ્યાવેલા સર્વ ઐતિહાસિક છે, નામેઃ—(૧) સિદ્ધધરાજ
જયસિંહના વખતમાં *સંજગન મંત્રીએ, (૨) વચ્ચતુપાત્ર
તેજપાત્ર નામના મંત્રીએ (૩), ચેથડ સુત અંગણે અને (૪)
અં. ૧૪૪૬ માં હુરપતિ શાહે કરેલા ઉદ્ઘાર છે.

આટલો દુંક સાર આ રાખનો છે.

* સંવત્ અચ્યાર ચેપરાસીએ, સાહ સાજણીં મોટો.

નેમિપ્રાસાદ કરાવીએ, શિવ વહુ સિર લોટો—

જગમાં જાગતા જસ ઠરી—૩૮

આજ ગિરનાર મિર જેઅ છિ, સુર ગિરિ જિમ જસીકિં
મોહીઅા માનવી મુનિવસ, તિહાંથી નવિં જસહિં—

ધંચવર ફેંકિ સોનદિઅડા, ઉપરિ બહોલ્યારિ લાખ
સાય વિત વાવરતાં થચો, જિવ અવન ચત શાખ—

સાય ભંદેણીએ, અરિઅણે, રાઓ મનમાંહી હુહુવાણે
ચેખિ પ્રાસાદ વિસારીએ, રાઓ પૂર્વ પરિઆણે—

ધિન ધિન માત જેહનિં સુતિં, એહુવો અમન કરાંએ
ધિજ મણુયદ્વા હે માવડી, સુતિં એહ સમરાવ્યો—

સાજણ સુણિ ન સુજ માવડી, ધિન ધિન કિમ લાણી,
સાય તુઝ હોકડે નીપનો, ભુવન એહ સુજ વાણી—

સંશોધન કાર્ય.

એક હુસ્તપત્ર ઉપરથી જંશોધન કાર્યમાં સંપૂર્ણ આ જંતોષકારક વિજય મેળવવો દુર્લભ નિવઢે છે. પહેલાં એકજ પત્ર અને તે પણ ધંધી નવી-ખ. ૧૬૩૭ માં લખાયેલી (નીચે જણાયેલી લખ પત્ર) મુનિ મહારાજ શ્રી બાલવિજયલું તરફથી મળી, અને તે ઉપરથીજ કરેલી પ્રેસકોપી પણ સાથે મળી. આ ધંધી અશૂદ્ધ હોવાથી બીજું એ પત્રો મેળાંચા વગર આ કુતિને પ્રસિદ્ધ આપવી અયોગ્ય લાગવાથી બીજું પત્રો મેળવવાને પ્રાયસ કરતાં ઉકા મુનિ મહારાજશ્રી બાલવિજયલુએ પોતાનાં પુસ્તક ભંડારમાંથી બીજું એ પત્રો (ક તથા ખ) પત્ર માફકાવી. સુંબધ વિરાજતા મુનિ મહારાજશ્રી ધંદ્રવિજયલું ઉપાધ્યાયે સુંબધનાં એક દેરાસરના ભંડારમાંથી પ્રાય કરેલી એક પત્ર (ગ પત્ર) મળે આપી. આ રીતે સર્વ મળી આર પ્રતમાંથી મેં મારી મૈળે તદ્દન સ્વતંત્ર જંશોધિત પ્રેસ કોપી કરી કે જેમાં જુનામાં જુની ખ. ૧૬૬૭ માં લખાયેલી ક પત્ર પરજ આસ અને પ્રધાનપણે આધાર રાખેલો છે જોડણી પણ તેનાજપરથી મૂકેલી છે- જે ફેરફાર કર્યો છે તે એટલોજ કે પહેલાં ‘ઓ’ પ્રત્યયને બદલે ‘ઈ’ લખાતો ‘ઓ’ને બદલે ‘ઉ’ લખાતું, તો તે ‘ઈ’ અને ‘ઉ’ ને બદલે પ્રચલિત એ અને ઓ મૂકેલ છે. ‘ઓ’ને બદલે પ્રાય:

એક હીનાર અહૃવા જિલ્લાબવધુ, લિઓ પુષ્ય ચિંહ કાનિ
શાય કદુઈ સુકૂત દોા સોચિનઈ, મુઝ માવડી લાજઈ,—

જિલ્લ ભવધુ પુષ્ય રાઇ શ્રદ્ધુ, આડ સાજણું દીધું,
ધણું ભવિં કીર્તિ જાખલી હુઈ, આગાઈ ચંખલ કીધું;—

શાય કોચિંગ હે જગિ જગો, પણું બદ્રક ભાવી
જિલ્લું જિમ કરી છણું તિમ ઠર્યું, એહુદો અઠલ જાખાવી.

—એક જુની પ્રતમાંથી—

૦૧૬૧૦ ૪૬૦

‘સ’ વપરાતો તે ઘનતાં સુધી કાયમ રાખેલ છે જ ને બદલે એ કખાતો ત્યાં જ વાપરેલ છે. હાખલા તરીકે ચંભારઈ-ચંભાર, આપણું-આપણે, પિહરિંનઈ-પેહરીને, પુરુષનઈ-પુરુષને, એહુ-વહુ-એહુવે; વડી-વડો, બીજી-બીજે, ચાંબલુ-ચાંબલો, મુહુરુ-ચોહોચ્ચે, કાશમીર તે કાશમીરને બદલે હોવેલા બેઠાંબે-પણ અને કાશમીર જ રાખેલ છે, દેખ (દિશ), સેટિ (થોડ)-સેઠે; સુષુપ્તે-સુષુપ્તે, ધર-જ્વા, ધમ-જમ; બાકી તે ખિંચાય જ્યાં ફાહુ અશુદ્ધતા હોય ત્યાં શુદ્ધતા કરી બેડલી કે પ્રતાંનીજ મૂકી છે કે કેલેથી ચંબત જાતરમા સૈકાની ગુજરાતી ભાષાનો પરિચય આપ્ય કૃતિ જાતરમા સૈકાનીજ છે અને તેજ સૈકામાં લખાયેલી પ્રત મળી છે, એ ઘટનાથી ચંચોધન કર્યમાં બણી અનુકૂળતા આવી છે. કઢીઓ પણ તેના પ્રમાણે મૂકી છે.

મળેલી ગતો.

ક—આમાં પ્રથમ અનમઃ સિર્દું એમ વખ્યું છે, અને છેવટે જણાંયું છે કે ‘ધતિ શ્રી ગિરિનાનિ તીર્થોદ્ધાર મહિમા પ્રથમ ચંપૂર્ખઃ ॥ શ્રીઃ ॥ ચંબત ૧૬૬૭ વર્ષે માગસર વદિ ર ખુષે લખતાં । શ્રીઃ શ્રીઃ શ્રીઃ

ખ—આમાં પહેલું પાનું નથી. તે ધણાં અર્બ પાનાપર એ પણ તેમાં લખ્યા ચંબત છેવટે મૂકેલ નથી. ક ની સાથે ચરખાવતાં તે ખ પ્રત ક ની આખાદ અક્ષરશઃ નકલ છે.

ગ—આ પ્રતમાં પહેલાં પ્રથમ એ શાખ્દો મૂક્યા છે કે ‘પઃ શ્રી કમતવર્દ્ધન ગણિ ગુરુભ્યો નમઃ’ છેવટે લખ્યા ચંબત કે લેખકનું નામ જણાવેલ નથી. આ પરથી એ સિર્દુ ચાય છે કે લેખક કમતવર્દ્ધનગણ્યોનો શિષ્ય થાય છે. પાનાં જોતાં તે ૧૬ મી વિક્રમ સહીનાં અંતમાં લખાયેલ છે.

ઘ—તેમાં પ્રથમ 'ॐ નમઃ શ્રી જિનાય શ્રી અંબિકાયૈ નમઃ
 પૂજ્યારાધ્ય ધ્યેતમ પંડિત શ્રી કદ્વાણુકુશલગણ્ય
 શિષ્ય પંડિત શ્રી તત્ત્વકુશલગણ્ય સદ્ગુરુ ચરણુ કમલે
 ક્યો નમો નમઃ' એટલું જણાવી છેવટે 'આ'. ૧૯૭૭. ના
 બાદવા શુદ્ધ ૧૧ ને વાર રવીએ સંપૂર્ણ. લ. નેસી લાધા
 ૧૦. મયારામ-જાતી વચ્છિક શ્રીમાલી શ્રાવકુ શેઠ શ્રી પ
 પ્રાગળને અર્થે લખું છે. શ્રી શ્રી' એ પ્રમાણે લખ્યા
 સંવત ને વેખકના વામનો નિર્દેશ ફરેલ છે. આ નવામાં
 નવી પ્રત છે ને તે બ્ય ની સાથે સરખ્ખવતાં તેની આબાદ
 અક્ષરશાઃ નકલ જ સિઙ્ગ થાય છે. હેઠી કયાંક વધુ (નવીન)
 મુડી છે. અને કયાંક રાગમાં ફેરફાર હે રાગની સાથે તાત
 મૂક્યો છે.

આ ઉપરાંત અક્ષરા શફદોની ટિપ્પણી પણ નિયે આપી
 છે કે જેથી અર્થ સમજવામાં મરલતા થાય આવી રીતે સંશો-
 ધન અને ટિપ્પણી આપવાનું કાર્ય ફરેક જેન શુર્જરહાઠ્ય. પ્રફટ
 કરતાં તેના પ્રકાશકો લક્ષમાં દેશે એમ ઈચ્છું છું.

તવા બિદીગિ, લોહાર ચાલ, સુંબધ માસ બાદ્રપદ ૧૯૭૫	} મોહનલાલ દલીયંક હેરાઈ, પી. એ. એલ એલ. પી. વકીલ હાઈ કોર્ટ.
---	---

॥ ॐ नमः सिद्धाय ॥

[कविवर नयसुंदर इत]

श्री गिरिनार तीर्थोद्घार रास ।

परतु (राम-डेशाख.)

स्वयं वासन स्वयं वासन वसे पथभूति,
 नमिसु निरंतर अतिभर, संतिकरण चडवीस जिनवर;
 नेमिनाथ धावीसमे। सीतरथण लंडार सुहुकर,
 तसु पथ पंकज अल्लुसरीये, महिमा गिरि गिरिनारि,
 सहि शुरु आहेश सिरि धरि, ओकसुं किंपि विचार. १

(राम-धन्यासी.)

उत्सर्पिष्ठि आरो ढाळ.*

किंपि विचार कहु भन रंगे, श्रुतहेवी आधारेण,
 वहन कमले वित्तसे वर वाणी, सा चामिष्ठि संभारेण. २

१ स्वयं-सकृत, वासन-ईदि पथभूति-पगना भूलमां, चातमा
 विभक्ति अतिभर-अडितथी भरीने संतिकरण-शांति करनार
 शण्डु-रत्न, सुहुकर-शुभंकर-शुभ करनार, पंकज-कमल क
 प्रत-पंक्ष पंख-सह-सारा अगर सहि-नक्षो आहेश-आजा
 क प्रत-आयस. किंपि-कंधपण.

* आटहुं क प्रतमां छे. ते ढाळने भील ध प्रतमां वधारीने
 जणावेत छे के:- ‘उत्सर्पिष्ठि अवसर्पिष्ठि आरो’ तेज प्रत ग
 प्रतमां भील हेशी भूझी छे ते पाण्डणथी भूझी छे. ‘विजय-
 सेनसूरि सूरि शिरोमष्टि, देवे रतिपति लतेणु ?

२-श्रुतहेवी-विधाहेवी, सरस्वती, संभारे-प्राचीन प्रतमां संभारह
 ए प्रमाणे ध छुटी लभाती. स्त्रा-तेणी, चामिष्ठि-स्वामिनी.

જાંયુ ક્રીષ ભરત ક્ષેત્રમાંહિ ઉત્તર દિસિ ઉદ્ઘારણ
 મનોહર કાખમીર હેસ મંડળુ, નવહૃત પત્તાન સાઠણ. ૩
 જિહું નવહૃતસ નામ છે નરવર, વિજયાહે તસ રાણીણ
 ચંદ્ર સેઠ તેલિ પુરિ અધિકારી, પુષ્પવંત તસુ પ્રાણીણ. ૪
 નંદન ત્રણુ તાસ છે નિર્દ્દ્રમ રતન વડો વ્યવહારીણ,
 બીજે મહન પૂરણલિંહ તીજે, નૈન ધર્મ અધિકારીણ. ૫
 લખમીવંત સુલક્ષણ શોલિત, તેજસ્વી પરતાપીણ,
 દ્રદ કુચા મુખે મીઠાં ખોલા, તસ કીરતિ જગ્યિ વ્યાપીણ. ૬
 વિનય વિવેઠ દાન શુણુ પૂરણ, રાય હિએ બહુ માનણ,
 વડ ખંધવ સો ખડા વિચકણુ, આવઠ રતન પ્રધાનણ. ૭
 રતન સેઠની ધરણી પદમિનિ, સીતવતિ સુવિચારણ,
 તેહનો સુત બાલક બુધ્વરંતો, કોમલ નામે કુમારણ. ૮
 નેમિનાથ નિરવાણુ પધાર્યા, વરસ સહુસ હૃદાં આઠણ,
 રતન સેઠ તેલિ અવસરિ હુંઓ અથેં એહવો પાઠણ. ૯
 અતિશય જાણી પદુ મહોદ્ય, વને પહોલા અધિરાજણ,
 શાન રતન સેઠ સુવિ વંદે, સીધાં વંચિત કાજણ. ૧૦

૪ વિજયાહે-વિજયા હેવી, હેવીનું કુંકું રૂપ 'ક' છે. તેલિ
 પુરિ-તે પુરમાં. બંનેને સાતખી વિભક્તિનોં ઈ મત્યય લાગ્યો
 છે. અધિકારી-માતાધીશ પદવી ધર.

૫ નંદન-પુત્ર, નિર્દ્રમ-અનૂર્પમ, વ્યવહારી-વેપારી. બીજે-
 પ્રાર્થીન પ્રતમાં બીજાઉ એમ લખાતું.

૬ દ્રદ કુચા-જેનો કુચા દ્રદ છે અભિંડ અદ્યાચારી.

૭ સે!-સા:-તે પ્રધાન-મુખ્ય.

૮ ધરણી-ગૃહિણી-સી. ૯ નિરવાણુ-નિર્વાણમાં-મોક્ષમાં, હૃદાં
 થયાં સેઠ-ક પ્રત સેઠિ-શેઠિ-શેઠ. ૧૦ પદુ-પદુધર ગ પ્રતા-પ્રોઢ.

રાગ અસાઉરી.

જ્ઞાન ધરો રે જ્ઞાન ચિત્તિ. ઢાડુ રે

સખા સહુ આગમલિ સો મુનિવર, ધરમ દેશના ભાસે રે
અવિક લુંબને સ્વભય હુરવા પ્રવચન વચન પ્રકાસે રે. ૧૧
ધરમ કરો રે ધરમ કરો ધુરિ, અરથ કૃષ્ણ ને કામેં રે.
ધરમ તથ્યાં શંખલ વિષુ કહો કિમ, પ્રાણી વંછિત પામેરે.

ધરમ કરો રે ધરમ કરો ધુરિ.—આંચલી. ૧૨

સોઈ ધર્મ હોઈ લેહે શાખ્યો, શ્રી આગમ જિનરાને રે,
સર્વ વિરતિ દેશવિરતિ અધિકારે, યતિ શ્રાવકને કાજેરે. ૧૩ ધૂ
પંચ મહાપત્ર ધારી મુનિવર, શ્રાવક વિસ્તા વિરતિ રે,
શ્રી જિન આણુ હોઈને અધિકી, દ્વાલાવ આજુસરતી રે ૧૪ ધ૦
પહીલું સમક્રિત શુદ્ધ કરેવા, શ્રી જિન લગતિ ઉદાર રે.
સો આરાધો ચ્યારે નિષેવે, એલો અનુયોગ દ્વાર રે ૧૫ ધ૦
નામ થાપના દ્રોધ ક્ષાવજિન, જિન નામા નામ જિનેરે,
ઠવણું જિનાતે જિનવર પ્રતિમા, સોહમ સ્વામિ વચ્ચ રે. ૧૬ ધ૦

૧૧ દેસના—દેશના. (‘શ’ લખાણુમાં ફહેલા એંઝે, વપરાતો—તેનેબદલે ‘સ’ વપરાતો.) -ઓપદેશ, અવિક-લાલુક-ભાડ-
વાળા-ભાવ્ય-મુમુક્ષુપ્રવચન-આગમ-શાસ્ત્ર. ૧૨ ધુરિ-પ્રથમ અર્થ-પ્રભા,
કામ-વિષયેચા-સંતત ઉત્પત્તિ કરવા વગેરેને પુરતી ચાર-પુરુષાર્થમાં
કામને ગણેલ છે. કામે-કામીઆવે લાવીઆપે. શંખલ-ભાતું ૧૩ સર્વ-વિર-
તિ-સર્વઅંશે મત લેના તે, દેશવિરતિ-દેશભાગે-અમુકઅંશે મન લેના તે
વિરતિ-વિરમણ, અનિષ્ટપ્રવત્તિમાંથી નિરૂપિત ૧૪ વિરતાવિરતી-વિરત અને
અવિરત એટલે મતધારી અને અપ્રતિ-એમ એ પ્રકારના શ્રાવક આણ્ણ-આ-
ગા સરખાવો. તને રામલક્ષ્મણુની આણુ છે ૧૫ નિષેવે-નિક્ષેપે ચાર
નિક્ષેપ એટલે આરોપણ છે-નામથી, ચિત્રાદિ સ્થાપનાથી, મૂળરસ્તુ એંગને
એટલે દ્રવ્યથી, અને તે દ્રવ્યમાં રહેલા અંતરગતિ સ્વાલાવિક ગુણ
એટદે ભાવથી. અનુયોગદાર-એ નામનું આગમ. ૧૬ ઠવણું-રથાપના
સોહમ-સુધર્મા (મહાવીરમણુના ૧૧ ગણુધરમાંના એક)

દ્રવ્ય જિન જિન જીવ કરીકે, વંદે ભરત નરેંદ્ર રે,
સમેા સરણું એઠા કે સ્વામિ તોતે ભાવ જિણુંદ રે. ૧૭ ધ૦
ભાવ જિણુંદ તણે જે વિરહે, જિન પ્રતિમા જિન સરખી રે,
દ્રવ્ય ભાવ પૂજા તસ સારે, ભવિજન પ્રવચન પણિખીરે. ૧૮ ધ૦
ભાવ પૂજા તે કહી સુનિવરને, શ્રાવકને દ્રવ્ય ભાવ રે
વિધિવાહે બોલી જિન પૂજા ક્ષવજ્જલ તરવા નાવરે. ૧૯ ધ૦
શ્રી જિન અંગે મજજુનાં કરતાં શત ઉપવાસનું પુછ્ય રે
દ્રવ્ય સુગંધ વિલેપન કરતાં, સહુસ લાલે ધન્ય રે, ૨૦ ધ૦
સુરભિ કુસુમમાલાએ પૂજે, લાલ લક્ષ ઉપવાસરે
નાટક ગીત કરે જિન આગલિ, લહે અનંત સુખ વાસરે. ૨૧ ધ૦
જિનવર ભગતિ તણું ઇલ એહુવા, જાણું ભાવ ધરીને રે,
વલી વિશેષ શેત્રુંજ્ય સેવા, લાલ પાર ન લહીનેરે. ૨૨ ધ૦
ભાગ એક શેત્રુંજ્ય કેરો તીરથ શ્રી ગિરિનારી રે.
નેમિ કલ્યાણુક ત્રણિણ હવાં જિહાં મહિમાં ન લહું પારરે ૨૩ ધ૦
પરશાસને પ્રભાસ પુરાણે જેને મૂકી માનરે
દૈવત નેમિ તણું કહે મહિમાં ઉમયાને ધશાનરે, ૨૪ ધ૦

૧૭ ભરતતે ઋપભદેવના પુત્ર કે જેણે ભરીચિ ચોવીસમાં જિનથણે એમ
ઋપભદેવપાસેથી જાણીને ભરીચિને વંદના કરી હતી. ૧૮ સારે-સતત
કરે, પરિખી પિણનિ ૨૦ મજજુન-સનાન

૨૧ સુરભિ-સુગંધી કુસુમ-પુત્ર. ૨૨ ગિરિનાર પર્વત તે મૂકુ
શાંતુંજ્ય (પાલીતાણું પાસેનો) પર્વતનો એક ભાગ હતો એમ ભાન્યતા
છે. જુઓ શાંતુંજ્ય મહાત્મ્ય, કલ્યાણુક-કલ્યાણુ કરનાર પ્રસંગો. નણ તે
દિક્ષા, કેવલગાન અને નિર્વાણુ નેમિ જિનના ગિરિનાર પર્વત પર થયા
હતા. ૨૪ ભાસન-મત-ધર્મ રેનત-ગિરિનાર પર્વતનું ખીજું નામ, ઉમયા
પાર્વતી દીસાન-ઘણ-શિવ

અલિ અધેન સામ ધ્યાન તણે, પખિ તપ જિહુંતજ્યો ભુરારિ રે
એ અધિકાર પ્રગટ તિહું દીસે.વામનને અવતારે રે. ૨૫ ૪૦

યદુક્તં પ્રભાસ પુરાણ-ઈશ્વરેણ પાર્વત્યાઽગ્રે
પદ્માસન સમાસનિઃ ઇથામ મૂર્તિ નિરંજનઃ ।
નેમિનાથઃ શિવેતાર્થ્યા નામ ચક્રેઽસ્ય વામનઃ ॥૨૬॥
રૈવતાદ્રા જિનો નેમિ યુગાદિર્વિમલાચલે
ક્રષ્ણાણ માશ્રમો દેવિ મુક્તિમાર્ગસ્ય કારણઃ
કળિકાલે મહાઘોરે સર્વકલ્પમષ નાશનઃ ।
ર્દ્ધનાત્ર સ્પર્શનાત્ર દેવી કોટિ યજ્ઞ ફલપ્રદઃ ॥૨૭॥
તથા સ્પૃષ્ટા શરૂંજયં તીર્થે ગત્વા રૈવતકાચલે ।
સ્નન્ત્વા ગજપદે કુંડે પુનર્જન્મો ન વિદ્યતે ॥
ઉચ્ચયંત ગિરો રમ્યે માદે કૃણચતુર્દશી
તસ્યાં જાઠારણ કત્વા સંજાતો નિર્મળો હરિઃ ॥

૨૫. અલિ-અલિરાજ ભુરારિ-શિવ. ૨૬-૨૭ અં. ચારથ્લોઝમાં ડેસમાં
મુક્તલા બે શ્લોક ગ-ધ પ્રતમાં મળે છે. તે આરેતું ભાષાંતરકર્તા
પહેલા શ્લોકનો અર્થ કંઈ સ્પષ્ટ થઈ શકતો નથી. પદ્માસન
પર વિરાલેલા શયામ મૂર્તિ નિરંજન એવા નેમિનાથ છે.
એમ શિવે ડલીને તેનું નામ વામન પાડું-[આવો કંઈક અર્થ લાગે
છે.] રૈવત પર્વત ઉપર નેમિ, વિમલાચલ-શેરુંજય પર યુગાદિનાથ-જ્ઞાન-
ખબર્દેવ, તે ઋષિઓને આશ્રમ-વિશ્રાભ ઇપ અને મુક્તિ ભર્યના [નિમિત્ત]
કારણું ઇપ દેવિ છે. મહા ધોર કલિ ડાલમાં તે સર્વ પાપના નાશ
કરનાર છે. અને હે હેણી! તેમનાં દર્શન તથા સ્પર્શ થવાથી તેઓ ડાટિ
ચરીના ફુલને આપનાર છે. ઉજયંત (ગીરનાર) નામના રમ્ય પર્વત
ઉપર મહામાસની અંધારી ચૈદશો જણગરણું કરીને નિર્મલ હરિ ઉત્પન્ન
થયો; ત્થા શરૂંજય તીર્થનો સ્પર્શ કરવાથી, રૈવતક પર્વત ઉપર જવાથી,
ચુંખદ કુઝમાં ન્હાવાથી પુનર્જન્મ થતો નથી.

રાગ પરણાં (રાગ અસાડી તથા ધન્યાસીમિશ્ર મ ધ પ્રત.)

શ્રી અરિહંત હીનો મુજ દરિસણ એ ઢાકું ત

(સુવિજન વંદો મુનિ આંગરીએંઓ એ દેશી ધ પ્રત.)

રૈવત ગિરિ નેમિસર મૂરતિ, ઉત્પત્તિનો અધિકારદે,
શ્રીરણ પ્રબ્રધ ને વલી બોલ્યું તે સુણુનો સુવિચારદે ૨૮
લાવિઅણ ભાવ ધણો મન આણી, સાલદી શ્રી ગુરુ વાણુદે
તીરથ યાત્રા તણાં કેલા જાણી જનમ સંક્રાંત કરો પ્રાણીદે. ૨૯
એણી ભરતે અતીત ચોવીસી, ત્રીજી સાગર સ્વામી દે,
ઉંનેણી રાજ નરવાહુન, પૂછે અવસર પામી દે. ૩૦ ભવ
કહુાએ સુગતી હુસ્યે સુજ દેવા, જિનવર કહે તિવારે દે
આગામિક ચોવીસીએ નેમિ, જિન ભાવીસમાને વારે દે. ૩૧ ભ૦
દ્વારસું સુણી સાગર જિન પાસે, સો નૃપ સંયમ દેખે દે.
પંચમ કદ્વપતણો પતિ હુદ્ધ. અવધિ જાત ધરેઠ દે. ૩૨ ભ૦

૨૮શ્રી જુનોપ્રબ્રધ કથાપુરણક. ચતુર્વિશાત પ્રબ્રધ હું ને રંતશેખર
સ્વારએ રચ્યું છે ને જેનું ભાષાંતર સ્વ. સાસરથી મણ્ણિલાલ નશ્શલાધારે
કરેલું ગાયકવોડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયું છે. તેનોજ જીત કુણી
ઉદ્વેખ કરે છે. એમ જણાય છે. ૨૯ અતીત ચોવીસી —

નાયલથા માંડી મહાવીર પર્યન્તના ચોવીસ તિર્યક્કર તે વર્તમાન ચોવીસી
કહેવાય છે. અને તેથી આગામના ૨૪ તિર્યક્કર તે અતીત ચોવીસી કહેવાય
છે. કે તેમાંના ત્રીજનું નામ સાગર સ્વામી છે; જ્યારે હવે થનાર ૨૪
તિર્યક્કરને અનાગત આગામીક લાવિષ્ટત ચોવીસી કહેવાય છે. ૩૨ દ્વારસુ-
ધશ-એનું સો તે પંચમ કદ્વપતિ પાંચમા કદ્વપોપવજ દેવલોકનો
સ્વામી એટલેહેલે. વૈમાનિક દેવતાના એ પ્રકાર નામે કદ્વપોપવજ, અને ક-
દ્વાતિત છે. કદ્વપ એટલે આચાર-તીર્થીકરોના પાંચ કદ્વાણું માં આવણું જરૂર
તેની રક્ષા કરવી વિગેરે દેવતા ‘કદ્વપોપવજ’ કહેવાય છે. તે આમારનું
માતન કરવાનો જેને અધીકાર નથી તે દેવ ‘કદ્વપાતિ’ કહેવાય છે. ક-
દ્વપોપવજ દેવતાના ખાર લોક છે. રૂસૈદર્ય, ૨ ઘણાન, ઉસનતકુમાર, રૂમાહેન્દ,

૫ ખલ, ૬ લાતક ૭ શુક, ૮ સહારા, ૯ આનત, ૧૦ પ્રાણુદ્ધ,
૧૧ આરણ, ૧૨ અચ્યુત આમાનો પાંચમો તે ભલ દેવલોક.

કીધું વજભર્યી મૃત્તિકાનું નેમિનાથનું બિંબ રે.

પરમ ભાવે પૂજે સો વાસવ દુસ સાગર અવિલંબ રે. ૩૩ ખ૦
નેમિનાથનાં ત્રણે કલ્યાણુક દૈવત ગિરિવરે જાણી રે
શોષ આચુ આપોવું લહીને, સા પ્રતિમાં તિહાં આંશી રે. ૩૪ ખ૦
ગિરી ગદ્યરમાં ચૈત મનોહર, ગર્ભ અહુ નિપાવે રે,
સોવજ રત્નમણી મૂરતિ, તિષ્ઠિકરી તિહાં ફાવે રે, ૩૫ ખ૦
કંચણુ ખલાનક નામે નીવાટું, ભુવન તે આગલે સાર રે,
વજ મૃત્તિકામય સા મૂરતિ, તિહાં થાવી મનોહાર રે. ૩૬ ખ૦
સો હરી નેમિનાથને વારે, હઉ નૃપ પુષ્યસારદે,
સંભદી નેમિ પાસે પૂરવલવ, આચુ ગિરી ગિરીનારિદે,
(નેમિ ઝુએ પૂરવલવ સમરી, પણુતો ગિરી ગિરીનારદે.

૧-૪-પ્રત — ૩૭ ખ૦

તિહાં નિજકુત જિન પ્રતિમાં પૂજુ, સુતને સોંપી રાજ રે
નેમિ પાસે સંયમ પ્રત પાલી, સાધું સધલું કાજ રે. ૩૮ ખ૦
દૈવત તીર્થ મૂલ છિતપત્તિ, પૂરવ પુરૂષે ભાખીરે,
સોનુંને મહાત્માંહિ વતી, વાત ઇસી પરિ દાખી રે ૩૯ ખ૦
વિમલગિરેં ઉદ્ધાર કરાવ્યા, કરતાદિક ને વારેં રે,
નેમિ ત્રણે કલ્યાણુક જાણી, રૈવત શિખરે તે વારેં રે. ૪૦ ખ૦
વર પ્રસાદ ભરાવી પ્રતીમા, જવ પાંડવ ઉદ્ધાર રે
થાવી લેપતાણી પ્રલુ મૂરતિ, તિહાં એહુવો અધીકાર રે. ૪૧ખ૦

૩૩-વજભર્યી-વજનેવી, મૃત્તિકા-માટી બિંબ-મૂર્તિ-પ્રતિબિંબ,
સાગર-એ એક કાલનું પ્રમાણુ છે. અસંખ્ય વર્તેતા એક
પદ્ધોપમ થાય છે, એવા દશ કોડા કોડી પદ્ધોપમનો એક સાં
ગરોપમ થાય છે. ૩૪ આપોવું, પોતાની મેળ. ૩૫ ગહર, શુદ્ધ ચૈતમંદીર
ગર્જાઅહ ખલારો નીપાવે-બનાવે, સોવજ,-સુનર્ધુ,-સોનું, કંચન, ૩૬-
ખલાનક-સા-સઃનું નારી જતિ. ૩૭ હરિ-દેવતા, ૩૮ સાધું-સાધ્ય, ચંનું
જ્ય મહાત્મ્ય નામનું પુસ્તક ધનેશ્વરસુરિકુત જેનું ભાષાંતર બીજાથી માણ્યો
તેમજ જૈનપત્રના મર્દુમ અધિપતી શ્રાગુલાઈ પ્રસ્ત્રયંદે મ્રગટ કરેલ છે.

ઈમ ગિરનારી તીરથનો મહીમા, અવધારી લવીદોક રે,
નેમીનાથની સેવા સારો, લહો અનંત સુખ થોક રે. ૪૨ ક્ષ૦

રાગ ધન્યાશ્રી

કનકકમલ પગલાં ઠવે એ-ઢાલ ૪ (ભારત લૃપ ભાવસું એ-એ ટેચી.
ધ પ્રત)

ઈમ સુણી સહુગુરુ દેશના એ, શાવક સોઈ રેલ કે
હુરખ ધરે ધણો એ.
સભા સહુકો દેખતા રે, કરે એ અભિગ્રહ ધન્ય કે. ૪૩
હુરખ ધરે ધણો એ-આંગલી.

આજથિકે। પ્રભુ મુહેને એ, પંચ વિષય પરિહાર કે, હું
ભૂમિ શયન અદ્ધાર્ય ધરું એ, લેઉં એકવાર આહાર કે હું ૪૪
સંઘ સહિત ગિરિનારિ જઈ, જિહાં નહી લેટું નેમ કે, હું
તિહાં લગી મે અગીકર્યો એ, એહ અભિગ્રહ ગ્રેમ કે. હું ૪૫
પ્રાણુ શરીર માંહી જે ધરું એ, તો કરું યાત્રા સાર કે હું
સહુગુરુનેં ઈમ વીનવી એ, પોહેચે ધરિ પરિવાર કે. હું ૪૬
રાય ગ્રતિ કરી વીનતી એ, લીધું મુહુરત ચંગ કે, હું
કંકાતારી પડાવીએ એ, થાનક થાવક રંગ કે, હું ૪૭
નથર માંહી ધોતાવીએ એ, જેહેને જોઈએ જેહ કે, હું
તે સાધ દ્યો મુજ પાસિથી એ, યાત્રા કરું ધરી નેહ કે હું ૪૮
સય (સંથ) સખલ ઈમ મેલીઉંએ, લોક નલાજે પાર કે હું
સેજ વાલાં સંખ્યા નહી એ, ગજરથ અથ વિહાર કે. હું ૪૯
પડહ અમારી વળાવીએ એ, શાંતિક લોજન વાર કે હું
ખંધ મુકાવ્યા અહુ પરિ એ, લોક પ્રતિ સત્કાર કે હું ૫૦

૪૨ સારા કરો, થોક-ઢગલો ૪૩ દેશના-ઉપદેશ. અભિગ્રહ-નીપમવિષેશ વિગ્રહ-
વિકૃતિ-તે વાપરવાથી વિકાર પ્રાપ્ત યાય તે. તે છે:- ૪૬ સહુગુરુ-સહુગુરુ
૪૭ ચંગ-મારી મરાઈમાં ' ચાગલા ' શાખ વખરાય એ. ૪૮ ધોપાવીએ
-સાદ પડાધ્યો. ૪૯ મેળીઉં-મુજું-ભેગું-યયું, સેજ-પથારી, ૫૦ અભાર્યિ-

કરતી ખરચ સોવન લર્થી એ, કહે સંખ્યાયતન રાય કે, હજ
સૈન્ય સખલ સાથે દીજાં એ, ઉલટ અંગે ન માય કે. હું ૫૧
શેઠાણી રાણી કહે એ. કરે મોકલા મણિ કાજ કે હું
રાણી કહેએ કૃપણ થઈ એ, રખેં આણ બોલા જાય કે હું ૫૨
દેતાં કર ખંચો રખે એ લખમી લ્યો સુજ પાસિ કે હું
હું તુમાહરી બહીનડી એ, જે કહા વિસિ સાભાસિ કે હું ૫૩
સંઘપતિ લિલક ધરાવિઉં એ, શ્રાવક રતન સુલણું કે હું ૫૦
કાટિધજ વ્યવહારીઆ અ, મિલિઆ રાણેારાણુ કે. હું ૫૪
દેવાલય સાથે ધણા એ, પૂજા લક્ષ્મિ જિણુંદ કે હું
ગંધર્વ ગાન કલા કરે રે એ, લાટ ભટ તે કહે છંદ કે હું ૫૫
જલ સુખનેં ડાંજે લીયાં એ, સાથેં ધરમ તળાવ કે. હું
સખલ સાચવણું સંધની એ, દિન દિન અધિકો ભાવ કે હું ૫૬
મારગે તીરથ વંદ્તા એ, સહશુરુ સાથે સુચંગ કે. હું
શેલા તોલા ગિરિ આવીયો એ, કુસલે સંઘલો સંધ કે હું ૫૭

રાગ સામેરી [એકતાદી-ધ પ્રત.]

ઢાલ પ્ર

શેલા તોલા પર્વતની ધારી, શ્રી સંધ ઉતરે જમ રે,
પુરુષ એક વિકરણ કુરૂપિ, સામે આવી કહે તામરે ૫૮

પડુ-કોધાએ જીવહિ સા કરવી નહિ તેવો પડો. શાંતિક-શાંતિસ્તોત્ર, બંધ
-માણીએ જીવો બંધનમાં હતાં તેખંધ: ૫૧ કરમ-સંખ્યાયતન-સખાપણ
ભાયથંધી. ૫૨ કહુને-કને. પાસે. પહેલાં ૬ વપરાતો હતો. જણીએ
કહું, કૃપણ-કંજૂસ થઈ મારાથી કેમ બોક્ષાય ચેમ આણુભોદ્યા રખે જતં
૫૩ કરું હાથ. ખંચો-ખેચી રાખો. એટલે જુટોન રાખો. કાલુવિસિ.
પૂર્વભાવાનું લવિષ્યકાગનું ૩૫. કહાવીશ- કહેનરાવશે, ૫૪ વ્યવહારીઆ
.વેપારી- વાણીઆટ રાણો રાણુ- રાણાએરાણુ-રાણાએ રાણ જેવા. ૫૫
ગંધર્વ- માયક+ગાનારા. ૫૬ ધરમ તળાવ- ચામડાનું તળાવ એટલે મસહે
-પખાલ ૫૭ કુસને-કુશલતાથી. ૫૮ ધારી- ધાર- એટલે પહાડ પર ધદ્દા
હતરતાનો રરતો, નિકરાલ (તિનુંપારે+કરુબળિધમણું) અંતિ ડરમણું.

સુષુયો (ને) સુષુયો રે લોકો એણિ થાનિક થિરથાઓ,
સુત્રને સમજાવ્યા પાએ. રખેવહીકો જાઓ રે ૫૬
સુષુન્લે સુષુન્લે રે લોકો આંચલી
અતિકાલો મસિ-પુંજતણું પરિ, સૂપડા સરિખા કાનરે
આધો નર આધો સિંહ સરિખો, દાંત કુહાડા સમાનરે સુ. ૬૦
મોટા સુંડલ સરિખું મસ્તક, પાવડા વીસે નખ દીસે રે
અદૃષ્ટાસ કરે અતિ ઉચ્ચ લોક પ્રતિઈ ખીછાવે રે સુ. ૬૧
નાખેંરે જનને વિદારવા લાગો હુંચો હાહારવ તામરે
રાજપુરષ સુભટ સવિ આવી, સો જોલાંયો શ્યામરે સુ. ૬૨
કુણુ તું હેવ અછે કે! દાનવકાં જનને સંતાપે રે
પૂજા દિક નોદ્ધારે તે માગો, જેમ સંધ્યાિતે આપે રે સુ. ૬૩
સો કહે મુજ સમજાવ્યા પાએ, પગ ને ભરશો કોઈરે
તો માહરા સુખમાંછી થધનેં, યમપુરિ જથો સોઈરે સુ. ૬૪

રાગ રામગિરી

લાણુજને જથ રાજ દેઈને ઢાલુ ૬
સો પુરુધની એ સુણી વાણી, થયાં વિલખાં મન
તે સુભટ શીધ્ર આવીયા, ખંધલી જિહાં રેતન્ન ૬૫

તામ-ત્યારે. ૫૬ સુષુયો-સુષુન્લે. પહેલાં જ ને બદ્લે ત્ય કુવચિતવપરાતો
થાનિક-સ્થાન+રથગ થિર-સિર પાએ-વગર વહી જાઓ- જાલ્યા જાઓ
૬૦ મસિ- પુંજ- મેશનો ટગલો. ૬૧ સુંડલ- સુંડલો- મોટો ટેપલો, પા-
વડો- એંચી ટેપલા તગરાં ભરવાનું ઓાજર- વીસે- અધા વીરા. અદૃષ્ટ
(સં-અદૃ મોટેથી+હાડા-હરાનું તે) ખડખડ હસવું તે. પ્રતિઈં પ્રત્યે-
સામું; ખીછાવે ખીવરાવે. [બુનું ૩૫]; ૬૨ વિદારવા-મારવા, હાહારવ-
હાહાકાર શોકનો ગભરાટ. સુભટ ચોક્કા. શ્યામ કાળો. [તે કાળાને
ઓલાયો જ્ઞાહવાહન જાસ્તું.]

દાનવ દૈવ, રાક્ષસ; ૬૫ વિલંઘો વિષખુણું શ્રીકાદુર, શીધ જખદી ૬૬

તૈણે વાત હુંતી તે કહી, સુણી વચન કર્યાં કાન
સંઘપતિ સવિ પરિવારસ્યુઃ, વિલખા થયા અસમાન ૬૬
ગુરિનારિ તીરથ જાયતાં, ઉપનો વચે અતરાય.
કહો હવે કુણ મતિ ડેલવી? કીજસ્યું કિસ્યો ઉપાય ૬૭
અતે હવો ડોલાહલ ધણો થાનકે થાનકે વાત
નાસવા હીડિ કાંધરા, મેહલી સવિ સંધાત: ૬૮
કામિનિજન ઉત્તરવ કરે; મને ધરે અતિ અદોક.
આહા આહા એહવું ઉચરે સૌસારે ધરના મોહ. ૬૯
એક કહે હવે પાછા વચો [દો] યાત્રા પોહોતી બાળ
જીવતો નર જે હોઈસ્યે તો પામે કલ્યાણ ૭૦
એક કહે ને હોઈ તે હોન્યો, અમૃત શુણી શ્રી જિનપાય
શ્રી નેમિજિન લેટ્યા વિના, પાછા વલી કુણુ બાય ૭૧
એક કહે લગન મંડાવીઈ, પૂછીયો જોરી જોશ,
એક સંબ પ્રસ્થાનક તણો, સુહુરત પતિ દીઓ દોષ ૭૨

હુંતી હતી. (પૂર્વ ૩૫), સું સાયે [પ્રત્યય નરનો છે.]. અસમાન
અતિશય. ૬૭ જાયતાં જાતાં[પૂર્વ ૩૫] જિપનો ઉત્પન્ન થયો; અતરાય અટકાવ
૬૮ હવો થયો; ડોલાહલ શોર, ધોંધાઈ; મેહલી મેહી [પૂર્વે હડેર વધ-
પ્રાતો હતો]; ૬૯ કામિનિજન ખી વગી; ઉત્તરવ [સ. કલ, અરુદ
કરવ, રડવું] અરુદુ ધની; અદોહ-અદેરો. [હા. અનદીશદ વિચાર,
જાય] ચીતા અભરાઈ; સાંખરે-યાદઆવે. વચો-વહો-ચાલો; -વડો-દૂરો
૭૧ શુણી-સ્તવી; કુણુ-કોણુ. ૭૨ લગન મંડાવવા [જરોતિપમા]. મૂ-
હુર્ત દ્રાવવું-દેવું. સમયની ઉધ્યાતીષ્ઠતા જોવી. પૂછીયો-પૂછો. (પૂર્વ ૩૫)
પ્રસ્થાનક-નીકળવું તો.

ચુંધવી સાહુસ આદર્દી, તેડીએ જન મધ્યસ્થ

જઈ પ્રીણો એ ખુર્દખને, શુભ વચન કરયો સ્વર્ગ ૭૩

એક કહે તે કીલુંએ, દીજે માગે નેહુ,

સુપરિ કરી સાંતોષીએ, રાખીએ પડતી રેહ

સાં પ્રેતતણે જઈ સુધીઉં, પ્રીણી વિનય વચન

તે કહે સાચું સાંભલયો, એણિ ગિરિ રહેા નિસિદ્ધિશ

સ્વામીએ છું આ ભૂમિનો, હુ દેવ દૃપે જાણિ

તુમેહ સંધનો પ્રધાન માણુસ એક આપો આણિ ૭૫

એકે સંહુ સંધ નિર્ભય થઈ એણિ પંચે પોઢાંએ એમિ

એ કથન જે નહી માનસો તો લેટસ્યો કિમ નોમિ

સો રતન સંધપતિ એહુદો સાંભલી સમાચાર

શ્રી સંધ કેસારી કરી યોલ્યા એ સુવિચાર ૭૬

રાગ વેરાડી (તાલ જયત ધ પ્રત.)

એ ઢાલ ૭

(ઢાલ વેલિનો કહેા પ્રલુ મુજ છે કેઠ ખહુ તેરો, એ દેશી. ગ ધ પ્રત.)

રતન સંધપતિ કહે સંધને વચન એક અવધારે

એણિ થાનકે હું રહિસિ એકદો તુમ્હે જઈ નેમિ જુહારો ૭૭

૭૩ તેડીએ-તેડા-યોલ્યાંયા; મધ્યસ્થ-તદ્દસ્થ-પંચ; પ્રીણો-પુણો

[પૂર્વ સંધાર્ય સુષ્પથં. પૂર્વ-પુણું] હાલ પ્રીણું એનો અર્થ સમજું, જાણું, એળખનું એવો થાપ છે. કરયો-કરજો; સ્વર્ગ-ચોખ્યું;

૭૪ સુપરિ-સારી રાતે; રેહ-રેખા રેહ પડતી રાખી-જતી આખર ઉગા-રવી; ૭૫ સાં તેમજ્ઞો-તેઓએ પ્રીણી-પૂર્ણા કરી; સાંભલયો-સાંભલજો-સાં-ભલો; ૭૬ પ્રધાન-મુખ્ય ૭૭ નિર્ભય-અંકિવમરનો; એમિ-ક્ષેમે કુશળતાથી;

૭૮ અન્ધારો-લક્ષ્મા લ્મો; રાહસી-રહીશ [પુર્વર્ણ]; જુહારો-પ્રલુભાડ્રો.

અથિર કલેવર આજ સંધને, કાને જો નહી આંકે
તો એણુ પછે કિસ્યું નીપજસ્યે મુઅને એહું ભાવે ૮૦
રાણીન્યા રાખિત સંઘલા કહે શોઠને તામ
ચિસંલુયો નસરતન તું, એહુ અમૃતાર્થ કામ ૮૧
સ્વામિ ! આપણા કરમે (કેવે) કાને, તૃણુ જિમ તનુ તોલીને
વૃત્તિ અમારી અષ્ટ્રા લોગબું તે ઓસ્સિકલ ઝીને ૮૨
તવ સાધમિક કહે સુ શ્રાવક, સુણો સંધપતિં વાત
જેણી નારે રલ કુખે તું ધરિયો, ધન ધન તે જગિ માત ૮૩
સહસ લક્ષનાં ઉદર ભરો તુમ્હે આસ્યા સહુની પૂરો
માન દીયો પૃથ્વી પતિ મોટાં, શુણુ નહી એક અધૂરો ૮૪
અમ્હે લુમંડલે ભાર કરેવા. અવતરીએ જગિ જણો
અમૃતા. એહુ અસાર કલેવર, સંધતિણુ ખપ આણો. ૮૫
મહન. પૂરણુ સિંહ બંધવ ઐહુ, કહે લાદળ સુણીએ,
વડ બંધવ તું પુન્ય અદ્ધારે, ઠામે પિતાને શુણીએ ૮૬

૮૦ અથિર-અસિથર કલેવર-દેહનું [પંડ], કાને-માર્ટે એણુ-એનાથે
કિસ્યું-શું કેવું; ભાવે-ગમે, ૮૧ રાણીન્યા-શુદ્ધ કૃતિપણીજના;
રાખિત-ખાદૂર પૂર્ણઃ ગધ પ્ર ચીરંભુયો-નસરતનતું; ૮૨ આપણાહર્મે-આ-
પના કામને; તૃણુ-ખડ તતું શરીર; તોલીને-લેખીએ; વૃત્તિ-નોકરીની;
આવક; ઓસ્સિકલ-ઓસ્સિમણુ-ઉપકૃત.

૮૩ સાધમિક-શ્રાવકતું વીરેષભુ-એટલે સમાન. ખર્મવાળા, ધન-
ધનમ, જગિ-જગમાં ૮૪ સહન-સહસ-હજરાં આસ્યા-આથાં. પૃથ્વીપતીન
જણ, ૮૫ કરેવા-કરવા [પૂર્ણ ૩૫]; અમૃતા-અમૃતાર્થ-અમારા : (ચા-
એ પુરેણી હ્રદી વિલક્ષણના મત્યઃ તરીકે વભરાતો હતો-દેશ મત્યઃ અનુભૂણ

પિતા તથે આધીન પુત્ર જિમ, તુલ્લ અહે હાસ તુલ્લારા,
તુલ્લ વિચોગે સૂના સંસારા, તુલ્લ કુદુંગ સિણુગારા ૮૫
આગે રામ આગલે લખમણે તુલ્લ જિમ તોલ્યા પ્રાણુ,
કાજ એહ અહાને લિરિ સોચો, તુલ્લ ને કુશલ કલ્યાણુ ૮૮

એ ટાકુ ૮

રાગ મારણી. પ્રોઉ રાખો રે પ્રાણુ આધાર.

પ્રીણ સંભળો રે પ્રાણુ આધાર, પ્રિયા પદમિની લાખે રે
તુલ્લ પાખે રે કુણુ ગતિ નારી, અહું જીવને કુણુ રાખે રે ૮૬
કુણુ નાખે રે એકલી બાળ, પ્રીયા પદમિની લાખે રે એ આંચલી
તુલ્લ વિચોગે એકલડી અખલા, કિમ રહે ધિરી નિરધાર રે
કેત વિના કાર્યિનિને સંધલે સૂનો એહ સંસાર રે ૯૦ પ્રિ.
વાલંભ તથે વિચોગે વનિતા, જનમ જુરંતા જય રે,
શરીર શોભા તે સયલ કારિમી ભૂષણ કૂષણ થાય રે. ૯૧ પ્રિ.
નિપુણ સુણો નર વિષુ નારી ને, ચડે અનેક કલંક રે,
આહ નિશિ ફુખ-નીસાસા મેલ્ણ, દીન બાપડી રંકે રે ૯૨ પ્રિ.

ભાપામા પ્રચક્તાત છે. તીણે-નેણે. ગુણીએ-મણીએ-લેણીએ. અહારે-અ-
હારે-અમારે પૂર્વ સર્વનામેમાં હ વપરાતો હતો તેનાં દૃષ્ટાત ધણો છે.
લખવામાં હ યા રહ એમ બેરીત હતી. જુઓ ત્યારપણીની કહી. ૯૭
આધીન-વરા. ૯૮ આગે-અગાઉ આગલે-પાસે-સંમુખ; સિરી-શીર-માથે
૯૯ રાખે-રક્ષાકરે-સાચને ૧૦ ધીરી-ધરે-ધેર ૧૧ વાલંભ-વલભ-વાલમ
-પતી વનીતા-સ્વી શરીરશોભા-૧૨ સયલ શોભા સયલ-સકળ-અધી કારિમી
(સં. કૃતીમ)-મૂલ અર્થમાં કૃતીમ-અનાર્ટી. હાલ આ અર્થમાં આ
ગણદ વંપરાતો નથી તે વીચીએ-અદ્ભુત સુંદર એવા એવા અર્થમાં હાલ
૧૫ । ૧ કે. ભૂષણ-શોભા આપત્તા એવા ધરેણો દુષ્ણ-દોષ-ખોડાપણ
નીમુદ્રા- [સં] ચતુર; દીન-લાચાર; બાપડી દ્વારામણી રંક ગરીબ.

પીહણે ને સાસરે પનોતી, પ્રીયુ વિષુ મુહૂર્ત ન લખીને રે
અશુકન ભાણી સન્મુખ વજો લૈકિક રંડા કહી જે રે. ૬૩ પ્રિ.
પતિ-આધીન સદા કુલનારી, પતિ જાવે પરદોકરે

પછે જીવતી તે પણુ ભૃતસમ પુરી પ્રીઓને શોંક રે ૬૪ પ્રિ.
એ ઉપરસર્ગ સહિસુ [સ] હું સ્વામી, તુલ્લને કુશલ કલ્યાણ રે
તુલ્લા અવર સુંદરીવર વરનો (ચો), હું તો તુલ્લ પગ
ત્રાણ રે. ૬૫ પ્રિ.

કોમલ સુત કહે સુણો પીતાજી, અહો સુતંદ્રે રણીઆને
જે સુત અવસરે કાજ ન આવે, ઉદ્ર-કીટક તે ભણીઆ રે
૬૬ પ્રિ.

તોત! સાંખદો રે સાચી વાત કોમલ સુત ધમ લાખે રે-આંચલી
મુજને એહ પલાદંતને આપી, તુલ્લ સંધ લેધ પોહેંચ્યા રે,
જનક જુઓ એણીવાતે જુગતું, રખે કોઈ ચિંતે સોચ્યા રે-૬૭ તાત
ખંધવ બેહુ પ્રતે તવ સંધવી, નીતિ ચુગતિ [વાત] સમજાવી
સંધ સંકલ સાંચરતો કીણો, સધળી શીખ કાલાવી રે. ૬૮ તાત.

કૃપીહરે. પીયરમાં; પનોતી સર્વ વાતે ભાગ્યશાલી હોય તેવી સ્ત્રી; શુભ
સ્થાન; મુહૂર્ત મહત્વ [પુર્વિષ્પ]; અશુકન અપશુકન વજો તજે, લૈકીક
લોકમાં; કહીને કહેવાય.

૬૯ સદા-હુંમેશાં; કુલનારી-સારાકુટુંખની-ભાનદાન સ્ત્રી; પ્રીઓ-
પ્રીયુ-ખતિ ૬૫ ઉપરસર્ગ-ઉપદ્રવ-પીડા-દુઃખ, સહિસુ-સહીશ [પુર્વિષ્પ]
સુંદરીવર-ઉત્તમ સુંદરી-નારી, વરનો-પરણુને; પગત્રાણ-પગરખું. સુત-
પુત્ર; રણીઆ-અણુભાળા-કરજદાર. ઉદ્ર-કીટક-પેનાકોડા ભણીઆ-
ભોલાયા-કહેવાયા. ૬૭ મુજને એહ પલાદંતને આપી-તેને ખદ્દે મુજને
એટલા દિન આપી-એ ગ-ધ પ્રતમાં છે. પલાદંતને-પહોળા દાંતવાળને;
જનક-પિતા; જુગતું-પોત્ય, સોચ્યો-શોચકરો-અષ્ટોસ કરો; નીતિ-પરસ્પર
વર્તનના નિયમ; ચુગતી-જુગતિથી આના ચ પ્રત્યચ છે તે કરણુ તૃતીયા
છે. જાંચરતો-ચાલતો; શીખ-શીખામણુ; શીખ ભળાવી-સધળી જ્યાલાવી

રાગ રામગિરી.

ઢાદ ૬

(તાત જ્યંત. પંથડો નિહાતુ રે ખીળ જિન તશોરે એ દેદી. ધ પ્રત)

બુચો બુચો ધૈર્ય સેઠનું રે સંધ કાને સાહસિક
આપણે અંગે આગમયું રે મહમાંહિ નીરલીક. ૬૬

ત્રણે જણા તિહાં કણિ રહ્યા રે, પતિ ખત્ની પુત્ર રે
અવર સનેહ થયા કાચિમારે, બુચો વાત વિચિત્ર રે ૧૦૦
ત્રણે જણા તિહાં તણિ રહ્યા રે

સંધ સૂઝુકો સાંચરે રે, કરી પાછું નિહાદેરે
નથણે આવણુ લાગીઓ રે, કુણિ કિંપિ ન ચાકે રે ૧૦૧ ત્ર.
શરણુ શ્રી નેમીનું આહરી રે, અનશન સાગાર રે
સંધપતિ ધીર થઈ રહ્યારે, સો કરે ફેટકાર રે ૧૦૨ ત્ર,
શુક્ર માંહિ લેધ ગયો રે, રહિઓ રંધા દ્વાર,
સિંહનેં નાદ સોદ કરે રે, ખીણાવે અપાર ૧૦૩ ત્ર.

શીખામણ રૂપે બલામણુ કરી. ૬૭ સાહસિક-ખાહસ-જોખમ ઘેડનાર.
આપણે પોતાને (પુર્વિપ) અંગે શરીર ઉપર આગમયું-આગમયું માથે
દીધું બહેરી લીધું એટલે પોતાને માથે લઈ લીધું, નિરલીક-ખીક વગરના
૧૦૦ તીહાં કણી-તે રથ્યે! અવર-ખીળ; કારીમા-કૃતીમ (મુળ અર્થ)
નથણે આવણુ લાગીઓ-આપે આવણુમાસ ઉભરાયો એટલે આસું આવ્યા
કુણી-કોઈ કીપી કીચિદભિ કંઈપણ; ૧૦૨ અનશન-અનાહાર આહારનો, ત્યાગ
સાગાર-આમાર એટલેં નીયમ સહીત, અથવા સાગાર એટસે, આપકનો, સોદ
તે (રાક્ષસ); ફેટકાર પ્ર. ફેટકાર, ખીણામણુ રાખદ.
૧૦૩ રંધા-કૃદ્યા-રંધણુ કર્યું સીહનેંનાદ-સીહનું કોવા નાદ-એટલે અયાણીએં

ક્રોમલ સુત પ્રિયા પદ્મમીનિ રે, ધરે કાઉસર્ગ ધ્યાન,
કંત જવ કષ્ટથી છુટસે રે, તવ કરસું અન્નપાન ૧૦૪ ન.
ઓહવે રૈવત પર્વતે રે. જાએ ઘેત્રપાલ સાત
આંખાઈને વંદવા રે, તેણે સુણો ઉત્પાત. ૧૦૫ ન.
તેણે જઈ અંખા વીનવી રે, કુર શખદ શ્યા વાગે રે,
પર્વત એક અતિ ધડે રે, ન હીઠું ધર્સયુ આગે રે ૧૦૬ ન.
ક્રોમલ મહાંત પુરધને રે ઉપરવ કરે હૃષ
જાને આંખાઈ મિહાલિં રૈ, હીઠું સંધપતી ક્રષ ૧૦૭ ન.
રાગ સામેરી. જયમાલાનો દાદ ૧૦

(રે કાજસીધાં સકળ હવે સાર એ દેશી ગ-ધ-પ્રત)
અંખાઈ જાણું એ વાત, ઘેત્રપાલ સાથે લેઈ સાન,
તેણી થાને ઉછક આવે, સો પ્રેતરૂપીને યોલાવે. ૧૦૮
ક્રોમલ સુત પદ્મમીની નારી. કાઉસર્ગ હીઠા સુવિચારી.
તે ઉપરી કૃપા સુલગતી. ઉપની આંખાઈને ચિતી ૧૦૯
પ્રેતરૂપી પ્રતી છિમ લાખે. તું કંબણ રહીયો મતીપાખે;
હું નામે હેવી આંખાઈ. એ ઘેત્રપાલ માહુરા સખાઈ. ૧૧૦

સોર ગ્ર૦ રો રો, સોર શોર મોટા સાદ. ૧૦૪ કાઉસર્ગ કાયોસર્ગ શરી-
રનું ભાનભુકી ભાનસીક ધ્યાનમાં તલ્વીન રહેલુંતે જવ ચદા. કંયારે
તવ તદા ત્યારે; ૧૦૫ રૈવત ગીરીનારનું થીલુ નામ-સુણો-પ્ર. સુણ્યો.
૧૦૬. કુર શખદ શ્યા વાગેરે પ્ર. કુર કુર શખદ સા વાગે ધર્ઢડે ગ. ક.
પ્રત. ધડે પ્ર. પ્રદ્રદે! છરસું ચાપું ૧૦૭ મહાંત મહાન ૧૦૮ તેણી થાને
રે ર્યાને! ઉછક-કુષક-અતુર. પ્રેતરૂપીને-ભૂત જૈવા રૂપરાળાને થુલગતિ
શુભસૂચક. મંગલ ઉપતી-ઉપકુ. ચિતી-ચીતમાં. આંખાઈ-માત્ર.

નેમી ચરણે વસું હું સદાધ. એ સાધર્મિક સુજ થાધ.

સંઘપતિ રાખું મેં એ ભૂજી, હોઠ શકતી તો સુજસું જુઝી ૧૧૧
તવ સો [પ્રેત] ધણું થરથરીએ. ચુદ્ધ માંડે સો કોપેં ભરીએ
તવ ચરણે અંખાઈ ધરીએ. રીતા સાથે આકૃતવા કરીએ. ૧૧૨
એતકેં સો સંવરી માયા, સોવન સમ જલકંતિ કાયા,
આભરણે સંપુરો હેવ, થયો પ્રગટ વૈમાનિક દેવ. ૧૧૩
સંઘપતિ સિરી ઉપરી તામ, પુષ્પવૃષ્ટિ કરી અભિરામ,
કહે તું ધન ધન વિવહારી, ધન ધન તુજ સુત એ વારી. ૧૧૪
જવ ચુડસુખે લીધાં તેં નીમ, મરણુંત લગે કરી સીમ,
અમી ન સક્યો તે પર સિદ્ધિ, તુજ ચિત્ત પરીખા કીધી. ૧૧૫
તું સૂધો સમકિત ધારી, તેં કુરગતિ હુરે નિવારી,
અલું ચિત્ત રાખું તેં ઢામી, તુદ્ધને ત્રૂઢા શ્રી નેમિ સ્વામી. ૧૧૬

૧૧૧ રાખું રક્ષા કરે, જુઝી-જાણી હોધ-હોય, સુજશું-મારીસાથે; જુઝી-જુજ
ચુદ્ધકરં ૧૧૨ સો તે; તવ ત્યારે; રીતા પથ્યર; આકૃતવા-પણાડવા.

૧૧૩ એટલેં એટસે, સંવરી-સકેકી; માયા-કપટી ઇપ. સંપુરો-સંપુરું
હેવ-હુવે; વૈમાનિક-હેવતાના અક પકાર-વીમાનવાળા દેવતા, જુઓ-પંચ-
મ કલ્પ પર ટીકા, કડી ઉરો. ૧૧૪ પુષ્પવૃષ્ટો પુલનોઉપરથીરસાદ,
અભીરામ-સુંદર, વીવહારી-વ્યવહારી-વાણીએ, વારી-જાઉ બલીહારી. ૧૧૫
મરણુંત મરણુના અંત સુધી. સીમ-સીમા-મર્યાદા, પરસીદ્ધી-વિષ્પાતી
પરીખા-પરીક્ષા. ૧૧૬ સૂધો શક સમકિત સમ્પદકત્વ. સત અસત વર્ણેનો
બેદ વીષેક-અથવા શુદ્ધદેન-ગુર ધર્મમાં અડગ અદ્ધા; નીવારી-દળા રાખું
ગ્રો રાખ્યું ઢામિ-ડેકાણું-ચીત ડેકાણે રાખ્યું એટલે સિધર ચિત રાખ્યું

ધન ધન એ તાહુરી કલત, પુષ્યવંત એ તાહુરા પુત્ર;
 ધન ધન હેવી અંખાઈ, જેણે સામી લગતિ નીપાઈ. ૧૧૭
 હું જુઝ કરું મન સૂધે, તો કુણે ન ચાલે ચુધ્યે.
 પણું કીડા માત્ર એ કીધું, તુઝ સાહુસ-પારણું લીધું. ૧૧૮
 મહી મોતી વૃદ્ધી ઉદાર, સંઘપતી ઉપરી કરી સાર,
 સંઘમાહિ મૂક્યા તેણીવાર. વરત્યો સંધ્યે જ્યજ્યડાર. ૧૧૯
 રાગ દેશાન ગ વ પ્રત.

એ કરનોડીને જુન પાએ લાગું—એ ઢાંડા ૧૨
 સો સુરવર સુરલોકે લાવે, આંખાઈક નીજ હામે સિધાવે.
 સહુ સંધ દૈવત ગિરિ આવે, સોલન કુલ મોતી યદે વધાવે ૧૨૦
 અતિ ચિત્તસ્થું શુલ લાવના લાવે તલહુરીએ ઉપગરણ તે ઢાવે
 જુન મુખ જોવા ને ઉત્સુક થાવે, શ્રી નેમી લેટીને પાપ શમાવે ૧૨૧
 ધોતી પહુરી થદ્ધનીર્મલ અગે સ્વાત્ર મહોચુછ્વ કરિવા સુસંગે
 આવીએ સુલ ગલારામાંહી ત્નાત્ર કરે જલ પ્રભદ પ્રવાહી ૧૨૨
 સંઘમાહીનહી શ્રાવક પાર. તેણુંબહુ વ્યાપી પાણી તણી ધાર.
 તવ તીઙું એક અસંભમ હોઈ, લેપમભ ર્ધીંગ ગદી ગણું સોઈ ૧૨૩

તૃપ્તા-તુલથ્યા-રાળ થયા. ૧૧૭ કલત-ખી; સામી ભક્તિ રવામી [સરંગર્મી] પ્રત્યેની ભક્તિ ૧૧૮ ને હું શુદ્ધ મનથી જુઝું-શુદ્ધ કરું તો કોઈ મને હુદ્ધાયી શકે નહિ; કીડામાત્ર-માત્ર રમતને ખાતર ૧૨૦-સુરવર-હિતમે હો. ૧૨૧ તલહુરીએ ઉપગરણ તે ઢાવે-તેને અદ્દે ઉપગરણ સહુ તલહુરીએ સંઢાવે—એવું અ-વ પ્રતમાંં. ઉપગરણ-ઉપગરણ-સામચા-તલહુરી-પ્રવિતતી તલેઠી, ઢાવે-સિથિત કરે-મુકે. મરાંદામાં ફેવ ધાતુ વપરાપણે, શમાવે-શાંત કરે-ટાળે ૧૨૨ સનાતમહોચુછ્ય-પ્રલુપ્રતમાને તનન કરવને લગતો મહેટો ઉસા. સુસ ગે-સારા પરિવાર સહિત ગસારા-ગર્ભશુદ્ધ ૧૨૩ અસંભ-અચંપ્યો, લેપમધ-ગોડીના સેંસનું.

સંધ સહું તવ ઝુંચ્યા વીશન્ન. એહ ધરે ધરો સંધવી રતને.
ધિગ મેં આશાતના કીધી, અણુનાણેતીરથ ભ્રષ્ટ કીધોચેછોડામે. ૧૨૪
હું કું આરોગિક્સ તો જલઅન્ન, જે ડામિ થાપિસિ બિંબેરતન
મનસાંથેં ઈમ આખડી કીધી, સંધ લલામણુ લાઈને કીધી ૧૨૫
અવર અંધાતમ સધવું છુટે, આપણું તપે કરિવા મંતે
સાહિ ઝુયા ઉપવાસ જિહ્વારે, અંબાઈ પરતબિ આવ્યાં તિહ્વારે ૧૨૬
કુંચન બલાનક નામે સુચંગ, ઈદ નિર્મિત પ્રાસાદ ઉત્તંગ
તિહ્વાં સંધવીને અંબાઈ લેઇ આવે, જિલ્લવર બિંબ તે સક્કલ
નુહારાવે. ૧૨૭

શ્રી નેમિનાથ યદા વિદ્યમાન, ઝુણું વિનિર્મિત બિંબ પ્રધાન
કુંચણું બલાનક પ્રાસાદ માંણી, તે સવિ હુરંધિં વંધા રતન
સાહિં ૧૨૮

સોચન રતન રજત મહિં કેશાં, બિંબ અઠાર અઠાર લલેરા
બિહુતરી બિંબમાણી ગમે જેહે, આંખા કહેલ્યો અહિં થક્કો
તેહે ૧૨૯

૧૨૪ વિષન-વિષણુણુ-વિલાસો, કાંતિલીમ-શોકાતુર, ધિગ...એ કરીને
દદ્દે ગંધ પ્રતમાં એમંછેકે ધિગ ધિગ મેં આશાતના
નાણિ. અનન્દે તીરથ બંશ કીઓ એણિ ઢાણિ આશાતના-
અપવિત્રના, દોષ, અણુનાણું-અનણ્યાં ! ભ્રષ્ટ-દુષ્પિત, ૧૨૫ બિંબગતન-
રનનું બિંબ પ્રતિમા, આખડી-આધા નિપમ, ૧૨૬ અંધાતમ-આતમાને
(આતમને પોતાને) લગતું છુટે-છોડીઓ, આપણું-પ્ર૦ આપણું-
પોતાની મેળે, જિહ્વારે-જયારેનું પૂર્વીપ, પરતબિ પ્રત્યક્ષન-સાક્ષાત્કાર, તિહ્વારે-
ત્યારેનું પૂર્વીપ. કુંચનબલાનક-સોચના જેલું-તે વિશેપ નામછે. સુચંગ-
ધરો સુંદર નાર્મિત-અનાવેલો, પ્રાસાદ-[મહેલ નેવું મંદીર ઉત્તંગ-ઉંચું].
૧૨૮ સોચન રૂરાનેખાલે કાંખ પ્રતમાં સોચન રતની રજત શેર તેરા એણો.

સ્યાથુનું બિંબ દેવા મતિ કીધી, આપણા નામની કરિયા મતિદી
સિખ સુમતિ હીએ તવ અંભાઈ, આગવે ડલિયુગ વ્યાપે

બાઈ ૧૩૦

લોક હુસે અતિ લોતી વિલમા, તેહ આજાડે નહીં છુટે એ પ્રતિમા
પાણાણું બિંબ લીએ તે માટે, સંઘપતિ કહે કિમ આવસે વાટે,

૧૩૧

અચેરે તાંતણું વીંઠી ચલાવો, મારગે એલિપરિ મૂરતિ લાવો,
જો કરી જેસ્યો ને કરસ્યો વિલંબ, તો તિહાંકણિ રહેસ્યે
એહાબિંબ ૧૩૨

એહ સીખામણું ચિત્તે ધારે, સ્યામ પાણાણુનું બિંબ લેઈ,
કેતલી ભુમિકા મેહલી આવે, સંઘપતિ રતન વિસમય તવ
પાવે ૧૩૩

આવે કે નાવે, એ વાટ વિચાલે, ઈસ્યું વિમાઝીને પુઠે નિઝાલે
તતભિણું બિંબ તિહાંથી ન હાલેં, પ્રાસાદ સ્યાના તિહાંકણિ
ચાલે ૧૩૪

તેણું ઢામે પ્રસાદ કરાંયો, સંધ ચતુર્વિધને ચિત્તે ભાંયો,
આજ લંજિં તેણું ઢામે પૂલએ, દરસણું હેઠી કુરીત પલાઈ ૧૩૫

નિષૃતી—ઓતેર. ૧૩૦ આપણા—પોતાનાં સુમતી—સારી ઝુક્કાળા ૧૩૧
હસે—પ્રસસ્યે લોતી, લોલુપ—લાલયુ; છુટે—છુટી રહે ૧૩૧ પાંચાચુ—થથર;
વાટ—રસ્તે કેમ આરસે? કારણુક પથ્યરતી એલે ઉપાડી મુશંગલ. ૧૩૨,
કરી—પુંડ. ૧૩૩, કેતલી—કેતલી; ભુમિકા—જમીન, ૧૩૪ વીચાલે—નયમાં;
વીમાતાને અદેશામાં પડીને; તતભિણ...હાલે—ને બદલે ગંધ. પ્રતમાં થયું—
થિર બીંબ ઊંછાં ચીત મહાલે! એમ છે. હાલે—ચાલે [પૂર્વીં ૩૪ હજુ કાડી—
યાડમાં વપરાયછે,] ૧૩૫, દુરીત—પાપ; પલાઈ—નાસે.

જનતુ

રેતન શ્રાવક રેતન શ્રાવક રતનમય જોઈ
 પૂરણુ પ્રતીજ્ઞા જોળુ કરીએ, સકલ દેવે પારએ પોહાતો
 અંધાઈ સાહસ લગે સંઘમાણી થાખ્યો સમુ હુતો,
 વર ગ્રાસાહ રચાવીઓએ, શ્રી ગિરિનારિ ઉદ્ધાર,
 નેમિ જિણેસર થાપીએ, વરંયો જ્ય જ્ય કાર ૧૩૬
 ઉલાલાની ઢાલ [૨૭] ધન્યાગ્રી-અતિશાય સહજના ચ્યાર-એહેશી
 ગ ધ-પ્રત. તથા જન્વડ સમરા ઉદ્ધાર-ધપ્રત.

ઢાલ ૧૨

પૂરી પ્રતિજ્ઞા એ ધીમ, સુધા સાચન્યા નીમ
 ધન ધન સાહુગીક ધીમ, વ્યય કર્યા સેવન ધીમ ૧૩૭
 યાચક વાંદિત પૂર્યા, હારિદ્ર હુભિયાના ચુર્યા
 તીરથ થાપના કીંધી; ત્રિભુવન કીરતિ લીધી. ૧૩૮
 વરતાં સંઘસ્યું લાભ્યા, સેનું જ્ય ગિરિ આભ્યા,
 અષલ લણેસર વાંધા, પાતિક મૂલ નિકંધા. ૧૩૯
 વિવિધ પરિ દ્વય વહેન્યાં, સુકૃત તણું તરું સીંચ્યા,
 નોરથ અદ્વર અનેડ. વંધા ધરી સુવિવેક ૧૪૦
 અરથ અપૂર્વ સાર્યા, આપણું તગરે પંથાર્યા,
 સાહુમા આભ્યા રાની, અદૃત કરાવે દીવાળ, ૧૪૧

૧૩૬ મારણે પોહાનો-પરીક્ષામ્રા પાર ઉત્યો, સાહસનગે-સાહસની
 સમુકૃતો સુમહાર-પ્રતીધ્રાવતો ૧૩૭, દૂરી-પ્રાર્ણ કરી ધીમ-ઓક્ફો
 સમુદ્દ્ર, સેનાનું હીમ થઈ ગયું એમ કાડીયાંગમારેપરાયણે,
 ૧૩૮. વરતાં-પાછાં આવતાં: નિકંધા-કાણા. ૧૪૦ પરી-રીતે
 તરું-ઝાડ, ૧૪૧ અર્થસાર્મા-ઝૂા ઝૂંણ અયા, અડુન-અયા [બહેત
 એ દિંદુઃથાનીમાં વર્ણાયછે:] દીવાળ-દીવા?— ખાંમધૂમ?

અહિ ધરિ મંગડ વૃદ્ધિ, કુશાદ કર્વાળું અમૃતિ,	
સામી વત્સલ કોને, સુકૃત ભડાર ભારીને,	૧૪૨
રતન સરિએ એ રતન, ધર્મ તણો કરે યતન,	
ચંદ્ર સૂરજની લગે નાંમ, જેણે રાખું અલિરામ:	૧૪૩
તીરથ શ્રી ગીર્લિનાર, આવક રતન એ સાર,	
શાપી શ્રી નેમિ સૂરતિ, આજ લગે એહ કીરતિ.	૧૪૪
અતિથર લખમી છે એહ, પદમી ક્ય કરે જેહ,	
કૃપલું પાણું મનિ નાણે, તેનો જશ જગત લાણે,	૧૪૫
ભરતાહિક હવા સંદવી, આજ નહીં કરદ્ધિ તેદવી,	
પામ્યા સારુ એ વાવો, તેહની ભાવના ભાવો.	૧૪૬
શ્રીશેત્રનુંજ ગિરી સાર, ભરતનો પ્રથમ ઉઢાર,	
પંચ પાંડવ લગે જેઈ, સો પણું ગિરિનારિ હેઈ,	૧૪૭
મહાતમ્ય જેનુંજ માણી, એહવું દીસે છે પ્રાણી,	
રતન શ્રાવક અધિકાર, જીરણું પ્રથ ધે છે સાર,	૧૪૮
શ્રીઅન શાસન દીપક, હુઆ કલિકાલ લુપક,	
આવક અવર અનેક, કુણે અહી લાણે છેદ,	૧૪૯
સિદ્ધરાય જેસિંગ-મહેતો, સાજન મંત્રી ગહુંઠાતો.	
સારી સોરઠ-કમાઈ, ણાર વરસ ઉધરાઈ.	૧૫૦

૧૪૨ સામીવત્સલ- સંદ્રભમી વત્સલથ, તેથાં સંદ્રભમની જમણ
આપવામાં હુંકાર્થમાં વપરાયછે, યતન-ઉધોગ. ૧૪૫, ૧૫-૧૫૫.
ધર્મવું: કૃપણુપણું-લોલીપણું નાણે-લાને નહિ: જગત-જ
ગતથ-ત્રણુજગત. પામવા માટે એ વાવો, ૧૪૭ ગિરિસાર-
ગ્રંગિરીનાર. ૧૪૮ પ્રાણી-પ્રાય: -સંભારીત રીતે અધિકાર-વર્જન-વિષય, જીરું-
પ્રાણંધ-જુઓ રતન શેખર સુરિકૃત ચતુર્વિશતિ પ્રાણંધ. ૧૪૯ શાસન-ધર્મરાજય
દીપક-દીપાવનાર; જીપક-જીતનાર, છેક-સંપુર્ણ અંત સુધી-છેડાલગી. ૧૫૦
સિદ્ધરાજ જેસિંગ-ગુજરાતનો અસીક રાજ. સ: થી સુધી પણણ
રાજધાનીમાં ગુજરાતની ઘાટીપર; મહેતો-મંત્રી પ્રધાન, સાજનમંત્રી-મ-

ને દ્વય રૈખતો વરીએ, જેમિ પ્રાસાદ ઉદ્ઘરાયો.

સો સિદ્ધરાયેં વખાણો, જસ સચરાચરે જાણો,

૧૫૧

શ્રી વસુગ તેજપાલ, મંત્રી-મુગાટ કૃપાલ,

શ્રીજીત ધરમ દીપાંબ્યા, પટહરશાલ મનિ ભાંબ્યા,

૧૫૨

શ્રીશ્રોતુંજ જિરિલિ, ડોડી અદાર તે ઉપરિ,

છનું લક્ષ પ્રસિદ્ધું, એટલું દ્વય વ્યય કૃધું,

૧૫૩

શ્રીગીરિનારિ ઓ બાર, ડોડી ઓંસીલાખ સાર,

અયુદ્ધ લુણુગ વસણી, ત્રિહીપન્ન લાખ બાર ડોડી કહી, ૧૫૪

એકુસો ચોત્રીસ ચાંગ, જૈન પ્રાસાદ ઉતુંગ,

એ સહસ વલિસે સાર, કીધા ગુરણ ઉદાર,

૧૫૫

શત નવ ચોસ્સસી વિશાલા, કીધી પૈષધશાળા,

ડોડી અદાર ધન ભાંબ્યા, જૈન લંડાર લખાંબ્યા,

૧૫૬

જજનમંત્રી ગહગછો-શોભતો, ૧૫૧ કમાઠ-આવદાની, ઉપ૪; ઉધરાઠ-
ઉધરાવી-લેગીકરી; ૧૫૨ વરીએ-વ્યય કર્યું-ખર્યું; ઉધરીયો-ઉદ્ધર, કર્યો,
જરૂરી મરામત કરી, વખાણો-વખાણ્યો. રાખારી આપી, જસ-જરા.
અચરાચર-ચર એટલે સળવ અને અચર એટલે જડ એ સર્વ સહીત
એટલે સર્વ; સર્વત્ર, વસુગ-પ્રસીદ્ધ વસુપાલ મંત્રી. ગુજરાતના વાધેલા
રાજ લવણુપ્રસાદનો મંત્રી સ્વર્ગિગમન સં.૨૨૪૮ પટ્ટ દર્શન-છદ્રાન્ત.તનાં
નામ બાદ, નૈયાયીક, સાંખ્ય, જૈત, વૈરોશિક, અને જૈમીતીય-જુયેષિડર્શન
સંમુચ્યા. ૧૫૪ લુણગવસલી-લવણુ વસતી- પોતાના સ્વર્ગે અયેલા બાંધ
લુણીગના શ્રેષ્ઠ અયોદ્ધ એટલે આયુ પર્વત કુપર જીનમસાદ બંધાંયો
તેતુ એ નામ આપ્યું. ૧૫૫ પૈષધશાલા જયા પૈષખા, પોસહ-ઓસો. થાયતે
આપકો આપોદીનને રત સર્વ પ્રટીતિ તજુ અપવાસ કરી ઉપાશ્રય યાધર
રથાનકર્માંજ રહી ધર્મકીયામાં ગાળવાનું રત તે પાંખષે, ને શુભ કરણીથી
આત્માના રવાખાવિક ગુણો નામે શાન, દર્શન અને ચારીન આદ્દિને પુષ્ટિ

હંતમય દીપતાં ઉંચ,	સિંહાસભ શતપંચ,	
જાદરમય સમોસરણુ,	પાંચસે પંચ શુલકરણુ,	૧૫૫
સંબા લાખ બિંબ ભરાવ્યાં,	સૂર્યિપદ એકવીશ થપાવ્યાં	
સ્વામીવિઘ્ન વરસમે બાર,	સંધ પૂજા ત્રિણી બાર,	૧૫૮
શરવાલે ત્રણિસે હોઈ,	સાતસે પ્રહૃષ્ટાવા નોઈ,	
કાપાલિક મઠ એતા,	સહિસ નેગી નીત જમિતાં,	૧૫૯
શાનુગર સય સાત, જોંા સહિસ હાન વિખ્યાત,		
વિદ્વામઠ શત પંચ, સાતસે કૂપ કસર		૧૬૦
શ્યારિસે ચાસઠ વાપી,	અહસુરી શત આપી,	
લ્લરોવર ચારાસી પ્રમાણુ,	અત્રીસ હુર્ગ પાધાણુ.	૧૬૧
શૈનુંને સાહું બાર યાત્ર, પોણ્યાં અનેક સુપાત્ર,		
તેરમી વારે એ મારગે,	સુરગતી પામી એ વસ્તુંગે	૧૬૨

મૈને છે તેનું નામ પૌષ્પવત વિશાળા-તિરાદ. મોટી ૧૫૭ હંતમય-[બાધી] દાંતના; જાદરમય કંધાને પરણાવતાં જે ધોળું રેશમી કુપડું પહેરાવે છે તેને જાદસું કુપડું કહેછે તે કુપડા વાલાં? સમોસરણુ તીર્થેકરની દેરના પ્રસંગેનો, સામાંડપ ૧૫૮ સુરીપદ આચાર્યની પદ્ધતિ એકવીશને આચાર્યપદ અપાવ્યાં વરસમે એક વરસમાં ૧૫૯ શરવાલે પ્રેર શીવાચ્ય. અલશાલા આનંદશ્રી માટેની શાલા. કાપાલીક માણુસના માથાની ખોપરીનો હારરાખનાર, શિન લક્ત સરખાવો-નોઈ વીજણું તણી અચ્યાંય, કપાલી જંગમને દુઃખ થાય ગીરખર. જમીતા જમતા શોજન કરના ૧૬૦ શાનુગર પ્ર૦શાનુકાર સત્રશાળા અભન્દગ પુર પાડવાનુ સદાવરતનુ ખામ. કસર પ્ર૦ કર્ણાસગ. ૧૬૧ વાપી-વાલ, અહસુરી અહસેરી આલખણું ધરનુ જે દાન આપેલું હુર્ગ ક્રીદ્યો. ૧૬૨ સુરગતી પ્ર૦ સદ્ગતી, સ્વર્ગમન. વસ્તુપાદ રવર્ગો ગયો. સં૧૨૬૬

તેતા મિથ્યાત હામ, કીંધા રાજિવા નામ;
 અબસર લણી અહીં આણ્યા, કેહુવા પ્રગંધે જણ્યા, ૧૬૩
 સવિ ધન વ્યય સંખ્યા નેડી, ચ્યાદ લાખ તેનીસે ડેડી.
 સહિસ અદારસે આઠ, ચિહું લોડીએ ઉરણ પાડ, (ગઘપત) ૧૬૪
 શ્રી પરવ ચિન્તલ દક્ષિણે, લગે પ્રલાસ પચ્છિમ લણી,
 ઉત્તર ડેદાર અહીએ, પૂર્વે વાળુંસરની લહીએ; ૧૬૫
 એણું પરિ હાન હેવા રસિ, કીરતિ વિસ્તારી ચિહુંહિસિ,
 ષટ દરિસણુ ડઃપવૃક્ષ, પામ્યું બિડ્રદ ગ્રત્યક્ષ, ૧૬૬
 પરસ અદાર માંહી કીધ, એ સની ડરણી પ્રસિદ્ધ,
 તે વિઘભાન ક્રેણવાયે, કીરતી આજ બોલાયે, ૧૬૭
 શ્રીરતનાકર સૂરી, ઉપદેસે પુન્ય પૂરી,
 સાહા પેથડે સુવિચાર. બાળું જૈન વિહાર, ૧૬૮
 સિદ્ધાચલ આટ ભુવન, ઘટિકા એકવીશ સોવન,
 વિદ્રવી રાજ્યું એ નામ, આ શશિ સૂરિજ જામ, ૧૬૯
 તસ સુત અંજણું સાર, સોવન ધ્વજ ગિરિનાર,
 નેમિ પ્રાસાદે એ ડાવી, સેતુંજય થિડો લાવી. ૧૭૦
 શ્રીજયતિલક સૂરીંદ જસ ઉપદેસે આણુંદ;
 શ્રી શ્રીમાલી વિભુતણ, હુરપતિ શાહવિચિક્ષણ, ૧૭૧

૧૬૩ હામ ગ્રે કામ. ભણી નાણી, લોડીએ ઉરણપાડ પ્રે ત્રિહુ લોડીએ
 ડણો એ પાડ. ગઘ-પત લોડી ? ૧૬૪ શ્રી પરવ...દક્ષિણે પ્રે શ્રી પર્વત
 દક્ષિણ નાણી પ્રલાસ પચ્છિમ લણી શ્રી પર્વત આ કંયા છે તે અભર નથી
 પ્રભાસ સોરણુ પ્રભાસપાટણ. ડેદાર એ પ્રસીદ્ધછે. વાળુંસરસી કાર્શી ૧૬૫-
 ૧૬૭ આ સર્વ ચતુર્વિશતી પ્રભાસમાંથાજ લીધુ જણ્યાયછે. કેમાં આપેલા
 વસ્તુપાલ પ્રભાસમાંજણુવેલ છે કે:- આ વસ્તુપાળ ને તેજપાળનાં ધર્મસ્થાન
 અસંખ્ય હતાં, તેવાં ડેણ કરી શક એમ છે ? પરતુ ગુર મુખે જે ઝાંઢ
 સાજણુ છે તે અને લખી રામાશ. જી ગિંબો સરાદંશ ડરણાં અને

વિદુમરાયથી વરસે, ચૌદસેં ઉગણુ પંચાસેં,
રૈવત પ્રાસાદ નેભિ, ઉદ્જરીએંબા અતિ પ્રેમિં
ઇમ મહા લાગ્ય અનેકે. શ્રાવક સકલ વિવેકે;
કીએ ગિરિનારિ ઉદ્જાર, કીમ કહી જાણું પાર,
રાગ ધન્યારી. (તથા સામેરી ધ અત)
ચીરાહી નગરી મુખમંડણ એ ઢાંકે ૧૩
શ્રી ગિરિનારી વિલૂપ્ષણુ સ્વામી, યાદું કુલ સણુગાર,
રાનુલ લશ રેંગે જધ વંહું, નિરૂપમ નેમિ કુમાર:
જગહીશ મળયો, જગહીશ મળયો.

અમ આંગણે સુસ્તરુ આજ કુદ્દ્યો.—જગાં ૧૭૪
ધન ધન શ્રી યહુવંશ વિચંદ્રણ સંમુદ્રવિજય ધન તાત.
ધન શિવાદેવી માત જેણે જાયો જિનજી જગાં વિખ્યાત ૧૭૫
ધન ધન શ્રીગિરિનારિ ગિરીધર, ધન ધન સહુસારામ;
પ્રણુમું શ્રી નેમીધર હીક્ષા, જ્ઞાન નિર્વાણ સું ઠામ. જગાં ૧૭૬
મૈધનાદાદિક ઐત્રય વંહિત હો સુત સાથે અંધાઈ,
નેમિનાથ યદ પંકજ ભ્રમરી, પૂજે પરમ સખાઈ-જગાં ૧૭૭
આસ્તિ કૃષ્ણ હુશે સા હેલી શ્રી સંઘ ચિંતિત પુરો,
ચિંતિત સિદ્ધિ કરો વલી સુરખદી, સિદ્ધિ વિનાયક સુરો-જગાં ૧૭૮

૧૮ કોડ અને ૮૬ લાખ દવ્ય શ્રી શશ્રુજય ઉપરે વાપર્યું; બારકોડ ને ચોંધી
લાખ ડિજર્જયની (ગીરીનાર] પર વાપર્યું બારકોડિ ને પચાશ લક્ષ અધૂર્દ
દિશખર [આણુ] પર વાપર્યું. લુણીગરસંતીમાં ૬૮૪ પોષખશાળા કરાય્યા,
પાંચસો દંતમય સિદ્ધાસંત કરાય્યા, પાંચસો ખંચ સમવસરણુ કરાય્યા,
સાતસો અલસાલા, સાતસો સત્રાગાર, સાતસો તપેરસીકાપાલીક મહ તથા સર્વ
ને માટે બોજનાદીની વ્યવસ્થા, એમ કરાયું ત્રણહનર મહેશરાયતનું
ત્રયોદશ શત અને ચાર શીખરઅછ જૈનપ્રાસાદ કેવીશસો લુણપ્રાસાદ-
રણ, કરાય્યાં. ૧૮ કોડ દવ્ય કરીને ત્રણ સ્થાને ત્રણ સરસ્વતી જાંડારસથ-
પાંદ્યા, પાંચસો આણણ નીત્યે વેદ પાઠ કરતા. વર્ષમાં ત્રણવાર સંધની
પુલ થતી, થેર નીત્ય પાંચસો અરણ્ણો વીહરતા, તરીક અર્પાટક એગણણીશ

માનવભાવ આર્થકુલ પામી, કરમ સાયને હામી,
 ઊજાલિ જઈ લેટો નેમી સ્વામી, સુગતી તણું જે કામી-જગીર ૧૭૬
 આજ અપુરવ દીવસ હુંવો મુજ, પાતિક દ્વારિ પલાયા,
 નેમિનાથ નીરખું નિજ નયણે, મનવંછિત ઝલ પાચા-જગીર ૧૮૦
 શ્રી ધનરત્ન સુરીંદ ગાણુધિપ, વડતપ ગાંધ શૂંગાર,
 અમરરત્ન સૂરિ પાટ પ્રલાંકર; દેવ રત્ન ગાણુધાર-જગીર ૧૮૧
 વિષુધ શિરોમણી લાનુ મેરુ ગણી સીસ ધરી આણુંદ,
 શ્રી દધિચામ માંહી હુખસંજન, વિનંધો નેમિ વિષુંદ-જગીર ૧૮૨
 કરો કૃપા નયસુંદર ઉપરિ, ધો પ્રલું શીવકર સાથ
 હેઠો સંધ્ય પ્રતિ શુલદાયક, સુપ્રસન નેમિનાથ-જગીર ૧૮૩
 (કલસ). એમ રૈવતા ચલ યાત્રાનાં ઝલ કિંબિ તસ મહીમાં બાળ
 આવીસમે અદવંત સ્વામી, નેમિ નાયક સંશુષેયો,
 શ્રી લાનુ મેરુ નાણુંદ સેવક, કહે નયસુંદર સદા
 સુવિશાલ દેવ દ્વારા અવીચલ આપે સુખ મંગળ સુદા. ૧૮૪

હજર નીત્ય જમતા. સંધ્ય કાઠીને ત્રયો દશ યાત્રા કરી. પ્રથમ યાત્રામાં ૪૫૦૦ ગાડાં, સુખપાલો સહીત ૭૦૦ સુખાસન, ૧૮૦૦ વાહીની, ૧૬૦૦ શેતાંખરો, ૧૧૦૦ દિગાંખરો, ૨૦૦૦ જૈન ગાયકો, ૩૬૦૦ બંદીજનો, એમ સંધ્ય હતો, ૨૪ તગાવ તેણે બંચાવ્યા; ૪૬૪ વાવ કરાવી, પાણાણુમય ડર કુર્ઝ કરાવ્યા. દંતમય જૈનરથ ૨૪ કરાવ્યા, વીસસો શાક ધાડીકા. સરસ્વતી કંદ્ંબારણાદી ચોવારી બિરદ, સાડ મસીદ એ પણ કરાડ્યું, શ્રી વસ્તુપાલની કર્તી દાંદણુમાં શ્રી પર્વત પર્વત, પદ્મિમમાં પ્રભાસ પર્વત, ઉત્તરમાં ડેદર પર્વત, પર્વતમાં વારાણસી પર્વત પ્રસરી બધુ મળાને તણુસો ડેટિ. ચતુર્દશ લક્ષ્મા, અષ્ટાદશ સહાય, અષ્ટણત, દ્વાયવ્યય તેણે કર્યો, ત્રેસડ વખત તેણે સંઘીમોમાં જ્યા પ્રાપ્ત કર્યો, તે મંત્રીઓ અદાર વર્ષ કારબાર ઉપર રહ્યાં.

૧૬૮ રત્નાકરસૂરી—રત્નાકર પંચવિશતી શ્તોત્રના કર્તી, વડતપગંદજ
 ના રત્નાકર ગચ્છના સ્થાપક સં. ૧૩૭૦ માં લુવબિચાર વૃત્તિ.
 રચનાર. સં. ૧૩૭૧ માં સમરાશાહે શૈનુંજયમાં પંદરમો ઉદ્ધાર
 કર્યો તે સ્વખતે ઋખસદેવની પ્રતીમાની પ્રતીષ્ઠા કરાવનાર લુચો.

વીશેષ માટે રત્નાકરસૂરી પરનો લેખ. સન ૧૯૧૩ ના જાન્યુ-
ફેબ્રુઆરી એંકુ જૈન થે. કે હેરલડ માર્ગીક; તથા મારો કુવિવર
નયસુંદર, પરનો લેખ આનંદકાવ્ય મહોદધિ ભાગ દર્શાવું છુ,
૧૦-૧૧, લેમણે પેથડને ઉપહેશ કર્યો તે પરીષ્ણામે પેથડ ખાલુ
જૈન વીહાર કરાવ્યા એ સમય જોતાં બંધ બેસતું નથી; ખરી
રીતે ધર્મધોષ સુરીએ ઉપહેશ કર્યો છે, જુઓ રત્નાકરસૂરી પેતાના
ગચ્છમાં થયા છે તેથી તો નયસુંદરે નામ નહીં આપ્યું હોય?

પેથડ—(જુઓ માંડવગઢનો મંત્રી પેથડકુ માર—એ નામનું નોવેલ
કે જે રત્નમંદેન ગણીકૃત સુકૃતસાગર કાવ્ય પરથી ઉપનિવેલું
છે. તેમાં તેના ઉપહેશક આચાર્ય તરીકે તપગચ્છ વાળા ધર્મ-
ધોષસૂરી જણાવેલ છે. માંડવગઢના રાના ન્યસરીહુદેવના સમયમાં
તે મંત્રી હતા, ધર્મધોષસૂરી તે દેવેંદ્રસુરી (સ્વ. ૧૩૭૪)ના
પદ્ધતિ હતા, તેના ઉપહેશથી પૂઢ્યીધર (પેથડ), શ્રાવકે લક્ષ
પ્રમાણ પરીશ્રહ લીધું, ૮૪ અન પ્રાસાદ. અને ૭, શાનકેશ.
કરાવ્યા, વીમલ પર્વત પર પ્રાસાદ કરાવ્યો (પદ્માવતી.) તો
સં, ૧૩૫૭ માં સુવર્ગસ્થ થયા, ૧૬૬ વીક્રમી-ખર્ચી, આ. શ-
શી....—જયાં સુધી ચંદ્રસૂર્ય છે ત્યાં સુધી—ચાવતચંદ્ર દીવાકરે,
૧૭૦. અંગણ-પેથડનો પુત્ર, તે પણ માંડવગઢનો, મંત્રી થયો. હુતો
ને પ્રતાપી હતો. તેણે શેનું જય અને ઉજાયંત (ગીરીન્દ્રા)
પર્વતપર ધાર ચોજન માન સુવર્ણને દૃવ્યમય દેવન કરી હતી.
(પદ્માવતી) તેણે સંધ વી. સં, ૧૩૪૦ માં કાદ્યો હતો.

૧૭૧. જયતીલક્ષ્મિ—ઉક્ત રત્નાકરસૂરીના અનુકમે શીષ્ય અને
રત્નસરીહસૂરી કે જેણે સં, ૧૪૬૪માં સીદ્ધાર્થીંકત ઉપહેશ માલા
વીવરણ રચેલાછે. તેના ગુરુ, જુઓ મારો કવીવર નયસુંદર પરનો
લેખ. તેના વખતમાં શ્રીમાલી હરમતિ શાહે સં, ૧૪૪૮ માં
ગીરિનાર પરના નેમીપ્રાસાદનો ઉદ્ઘાર કર્યો હેવું. આ રાસમાં જ-
ખુાવેલું છે તે સમયને બંધ બેસે છે.

૧૭૫. જ્ઞાત્ર-જગત્ય, ત્રણજગત; ૧૭૬. સહસરામ—સહસ્રાવન
જેને હાલ કહેવામાં આવેછે તે. ૧૭૭. ઐત્રય-પ્રઠાચક્ષય, મેધનાદ-
રાવખુના પુત્રનું નામ મેધનાદ છે, તે નહીં, પણ અધીષ્ણાયક દે
વતા. નામે કાળમેધ, દંડ, અંદેંદ, રદ, અદ્વિતિનાથ, વગેરે માના

એ સુત-બેપુત્ર. અંબાજીના બે પુત્ર, આ સંખ્યામાં એવી કથા છે કે રૈવત ગીરીની દક્ષિણ દિશાના કુષેર નગર [કોડીનાર] માં સોમભટ નામે જુદ્ધિશાળી પ્રાણણુ રાજની પત્ની અંધીકા હતી, તેણીએ એકદા એ અવણુને શુદ્ધ આહાર વહેરાવ્યો, આથી લેણીની સાસુને પદીથી ખખર પડતાં ડેપાયમાન થઈ, પત્તી પણ અવજ્ઞા કરવા લાગ્યો એટલે અંધીકાએ પોતાના બે પુત્રો અંબર ને શાંખર લઈ રૈવતગીરી નું શરણ લેવા ચાલી નીકળી, માર્ગમાં ઉત્તમ ભાવ ભાવી કુવામાં પડી આત્મધાત કર્યો, પત્તીએ પણ પાછળથી આવતાં તેણે પણ તેમજ કર્યું, પત્તીનો જીવ અંધીકાના વાહન રૂપે શાર્ફલ હેવતા થયો, અને અંબા તે બંને પુત્રની સાથે સેના જેવી કાંતી ઘારણુ કરી હેવી પણે પ્રગટ થઈ, ને નેમીનાથે સ્વતીર્થના શાસનનો અધીષ્ઠયક। હેવી સ્થાપી, જુઓ ગીરીનાર મહાત્મ્ય.]

નેમી....અમરી-નેમીનાથના અરણુ રૂપી કમલ પર ભમરી રૂપે સાખાદ-સખી. ૧૭૮ આરતી-આર્તિ-ધીકા સુરબ્લ-૫૦ સુરવર. ઘણવાલ યા ઉત્તમ હેવ બળિભદ્ર નામનો અધીષ્ઠયક હેવ. સીંકી વીના-યક-શત્રુંજય માહાત્મેયમાં જાણુનેલું છે કે ખજસેધ, ઢૂર, ખહેર, રૂર, મહદીનાથ, અળબદ્ર, વાયુ, ઉત્તર કુર્દની સાત મતા, કેદાર. મૈધનાદ, સાદ્ધિલાસ્ય, સીહુનાદ, કળેર અધીષ્ઠયક હેવતાંએ પ્રત્યેક શીખરે અને પ્રત્યેક વૃક્ષે નેમીધરના ધ્યાનમાં તાત્પર રહી સંધના કણ્ઠ ફૂર કરે છે ને અંબાના ગીરીથી દક્ષિણે ગોમેધ યક્ષ છે તથા ઉત્તરે મહુજ્જવાલા હેવી છે, તે પણ સંધના વીજન હુરેછે, આમાંના સિદ્ધિલાસ્ય હેવ, ૧૭૯ દાભી-દમન કરી. જી-જલી જઈ લેટો-૫૦ ઊજલગીરી લેટયા ઊજલીયા ઊજલગીરી તે ઊજય-તગીરી નું અપણા રૂપ છે-ગીરીનાર પર્વત, ૧૮૧ ગણુધીપ- ગણુ એટલે સાધુનો સમુદ્ધાય તેના અધીપ એટલે સ્વામી, ગણુધીશ, ગણી-આચાર્ય શુંગાર-શાણુગાર; પ્રલાકર-સુર્ય. ગણુધાર-ગણી-ગણુધીપ, ૧૮૨ વીણુધ-ડાદ્યા પુરુષ. ધી-શ્રામ-હુલની દેહથલી, ૧૮૩, શીવપુર-કલ્યાણની નગરી, મોક્ષ સાથ-સથવારો. ૧૮૪ સંશુદ્ધ્યો-દત્તવ્યો, સુવીશાલ-મહાન; અર્વીચા-કાબમનું, સુદા-(સ.) ફર્ખથી, . . . સમાપ્ત.

પ્રસ્તાવ.

‘શ્રી ગિરિનાર તીર્થમાલા’ એ ૧૦૩ કંડીનું વર્ષનારમદ્દ કાળ્યાં
છે ને તેમાં રસજનક આવ્યત્વ સંભવતું નથી. આના રચનાર ન્યાયસા-
ગર છે કે કેવેણું આમાંજ રચનાનો સમય સંવત્ ૧૮૭૫ના માઘશુહિ
દિને શુરૂવાર આપેલાછે. અને પોતાના શુરૂનું નામ વિવેક (સાગર)
જથ્થાવેલાછે [શુરૂ વિવેકપસારા એ પરથી. આની પ્રત મુની શ્રી ધ્રા-
દ્વારિજયલુએ કુદ્ધમાંથી મોકલી તે પ્રત પરથી આ ઉત્તારવામાં આ-
વેલાછે. આ પ્રતનાં બણ્યું પણાં છે—ઇ પૃષ્ઠાને તે દરેકમાં પદ્ધિતા ૧૩
છે તેમાં લખ્યા સંવત્ ૧૯૪ આપેલ નથી. પ્રત જોતાં અર્વાચીન જ-
થ્યાયાંથી. બીજું પ્રતો ન મળ્યાથી આ એકજ પ્રત પરથી કાર્ય લેવામાં
આંખું છે. આ પ્રત મેળવી આપવા માટે ડિકર મુનીશ્રીનો ઉપ્પદાર
થયોછે.]

‘ગિરિનાર’ ની જાતા કરી કલિએ પોતાની આંખે ને જેથું
તે જાણ્યાવેલુંછે. જુઓપ કંડી ૮૮ તથા ૧૦૦

‘ઈત્યાદિક ગિરનારનાં બહુ ઢાંખું અનેરાં
છે પણ જેટલું ભાલીએ તેતલું ઈછાં સારા
શાખ્યું નિજરે જોઈને તે સહી કરી માનો
સધલાં તીર્થનો નાયક ગિરનાર વખાણો.

પંડીત ન્યાયસાગર નિર્વાણ રાસ્તે એ સાક્ષર મુનિશ્રી જિન
વિજયે પોતાના જૈન ઔતિહાસિક શુર્જર આવ્ય સંચયમાં પ્રકટ ક-
રેલાછે તેમાં વર્ષાવેલા ન્યાયસાગર તપગચ્છીય ઉત્તમસાગરનાં શિષ્ય
હુતા. તેમનો જન્મ સં. ૧૭૮૮ માં નવર્ષની વર્ષે દીક્ષાલઈ સં.
૧૭૯૭ માં સ્વર્ગસ્થ યથાં તેમણે ચોવીશી (ચોવીશાનિનસ્તવનાવલિ)

વીશી (વીસ વિહુરમાન જિન સ્તવનાવલિ) મહાવીર
રાખમાલા સં. ૧૭૮૪ ધનતેરસે બુદ્ધ બુદ્ધ રાગમાં જેવા
કે માલકેશ વગેરે—નિગોદ વિચાર અર્ભિત મહાવીર સ્તવન સમ્યકૃત્વ
વિચાર અર્ભિત મહાવીર સ્તવન સં. ૧૭૬૬ લાદ્રપદશુદ્ધીપ તથા તે
પર આદ્યાવષોધ ગુર્જર ભાષામાં સં. ૧૭૭૪માં રચેલછે. આ ન્યાય
સાગરથી પ્રસ્તુતન્યાય સાગર કિન્નછે.

પ્રસ્તુત કાંય રચાયાને પૂરાં એકસે વર્ણ થઈગયા તે વખતે
જિરનારની શું સ્થિતિ હતી તેને કેટલોક ચિતાર આમાં આપેલછે
તે પરથી હુકાની સ્થિતિ સરખાવી શકાય તેમછે, અને તેમ કરી એકસે
વર્ણમાં શું ફેરફાર અમેલ તે બલણી શકાય તેમછે

આ કૃતિની ભાષા સરદાછે અને તેમાં કઠિન શફ્ટોના અર્થતથા
સમજૂતિ નીચે આપેલછે તેથી સાર આપવાની જરૂર જોઈ નથી

મુંખું પ્રિન્સેપ સ્ટ્રીટ }
ચૈન્સન્સ્થુડી ૧ સં. ૧૯૭૮ } મોહનલાલ દલીયંદ દેશાધ.



ન્યાયવિજ્ય કૃત.

શ્રી ગિરનાર તીર્થમાલા.

કૃષ્ણજી એલેરે ગોકલે કેહેરે રાધા ન્યારે એ દેશી.

સરસતિ માત મથા કરી દીજે વયષુ રસાલ

શ્રી ગિરનાર ગિરિ તણ્ણી, કહું તીરથમાલઃ

૧

એ પણ સિદ્ધગિરિ કુંક છે, ખીળુ સુવિશાલ

કાંકરે કાંકરે સિદ્ધજી, અનંત સંભાલો

૨

રૈવતા ચલને મૂલને કુનોગઢ લાગો.

માંહ ત્રિશલા નંદને દેહરે સંભાલો

૩

ધાતુની પઠિમા સાડ છે, ખીળ ચ્યાત્રીસઃ

જિન ચ્યાત્રીસ દટાલા, ઈચ્છાર કહીસ.

૪

તેહને સન્મુખ ચ્યામુઘે, જિન ચ્યાર લહીસઃ

તે પ્રાણુમીનેં ચાલીઈ, રૈવતાજલ જઈઝ..

૫

મારગ જોધાલાવથી, નીકસી દરવાને

જમાણ વાધેસરી જોઈઝ, ખૂંદેં સરોવર છાંને.

૬

આગલ વાત સોહામહણી, જલમ ખાંને ખનાઈ,

ચાલતાં આડી માંહ છે, દોય પ્રવત ભાઈ.

૭

૧. સરસ્વતિની રહુતિ કરી ગિરનારની તીર્થમાલા કવી શર કરેછે, કવીનું નામ ન્યાય સાગરછે [૨] ગિરનારએ સિદ્ધાચલ. [પાલીતાણાતો શુંભુઅયગિરિ.] નીએક કુંકછે એવો હિલ્લેખ શંખજ્ય મહાત્ર્યમાં કરેલછે. કેને શંખજ્ય એક મહાતીર્થજીનોનું ગણ્યપ્રાપ્ત અને જેના સંખ્યાએ એમ કહેવામાં આવેછે કે તે ના દરેક કાંકરે સિદ્ધ્ય થયા છે એટલે તેના દરેક બાગે મોક્ષ જયેલા જીવોએ અગર તેતા કેટલા કાંકરા છે તેટલાજીવો તેગીએ [૪૨] મકા થયાએ [૩] ગિરનારનું ખીળુ નામરેવતાચલ તેમજ ઉજણ્યંતગિતએછે ત્રિશલા નંદન એદ્દે માતા. ત્રિશલાના પુત્ર તે મહાતીર્થસ્વામી [૭] જલમખાન આ નામતો.

તે ખીચમાંથી ઈંવાલતાં, આવી હેરી નજુક શિવની સુરત તેહમાં, જુઓ નજરે ઠીક સરિતા પાજ ઉલંઘતાં, તિહાં આડી પ્રચંડ પંથ વહેતાં આવીઓ, દામોદર કુંડ.	૮
તેહને ઉપર સોણીઈ, દામોદર હેવા વૈષ્ણવ જિન નાહી કરી, કરે નવ નવ સેવા.	૧૦
રાધિકા ઝપ સોણામણું નરસિંહ મેતાંને હાર આન્યો તેરે જાણીઈ, સવી દુખ એવાને.	૧૧
દેરાં ન્યારને હેઠરી, સવે મળીને રે વીસ એ પણ વૈષ્ણવનાં છે, સવી થાંન જગીસ	૧૨
આગલ હતુમાંત વીર છે, વેરાગી અખાડે નાનકપંથી તિહાં વસે સહૂ વિજ્ઞાને કાઢે	૧૩
જાંગી જાંગી લોાક છે, તેહના રેહનારા, દાના દિક કિરિયા નહી, નહી ધર્મ વિચારા.	૧૪
તે જોઈ મારણ ચાલતાં, ભૂગી કુંડ સૂહાવે, શિવનાં થાનક દીપતાં, દેહરાં ગ્રણ દીપાવે	૧૫

કોઈસુખોથોનથી. નાનકખાનઈ સં. ૧૬૮૦માં યચેકછેતેકદાચ હોથલે નાનથી.
૧૧નરસિંહહહેતા-તે જુનામટમાંરા.માંડળિકાભીજે(૮.સં ૧૪૮૧ થી ૧૪૮૨-૭૩
સુધી રાજ્યકર્ણ કો.સ સંમન. નરમંગદમાં સં. ૧૪૮૮ થી ૧૪૮૯ સુધી રાજ્યકર્ણ
અંગંભાવેલુછે,) નાસમયમાં વિષણુ લક્ષ્મા તરીક પ્રભ્વાત યેલાછે. દારની
વાતએવીછે રાન્નાને કોઈએ લરાવ્યું નરસિંહાણું છતાં કૃષ્ણાલક્ષ્મિતગાયએ
ને લોકની અખાડે ડાડાઉછે નેઓઓ. સંચે વીહાર કરેછે. આથી તે રાજ્યે
દામોદરના મદીરમા સાંભા કરી નરસિંહને કહુંકે સુર્તિને હું જોયા હાર ચડાવું
છું તે હાર જો તારી કોટમી જ્યાવેતો તું સાચો બાજી પાખંડી સમામાં સમર્થ
બીજાનુસંન્યાસીઓ જાણે નરસિંહે વાદ કર્યાને પછી કૃષ્ણ તું કરમરીને ખાન
ખર્યુ ગ્રાટલે કૃષ્ણ તેને હાર પહેરાવ્યો-(નરમંગદ) (૧૩) વિજ્ઞા બાંગ. ૧૪
જાંગી જાંગી જાંગી રંગી રંગી બાંગ પીનેખુથ રેનારાભોળા ૧૫ સુહાવે શોલે.

શાંકર નાગર તેહની, વાવડી જલ પીએંચો;	
તિહાં વીસામો લેઇને, મુનિને અજ દીએંચો	૧૬
પાય ધરંતા વાવડી, સંઘના તથ આવી	
વિનયવિજયની પાહુકા, શ્રી સંદે ખનાઈ.	૧૭
તલહઠી પૂરી થઈ, નેમના શુણુ ગાઈ.	
ત્રણુ અમાસથુ દેઇને, હવે અડીએરે ભાઈ,	૧૮
ચઢવા માંડયો જેતલે, નવ અલીએ અપાવે	
મારગ પાંડવ પાંચની, પાંચ દેહરી આવે.	૧૯
દ્રાપદીની છઠી કણી, દેહરી દીપાવે	
આગલ આંખલી હેઠલે, વીસામો રે થાવે	૨૦
તદનંતર નીલી પર્વ છે વીસામાનું ઠામ,	
કાલી પર્વ બીજી કણી, એસો શુણી જિન તામ.	૨૧
ધોલી પર્વ ત્રીજી ને, નેમના શુણુ આવે,	
દાડુ અમૃત બાધની, પાંચમી મન શાવે	૨૨
છઠી માલી પર્વને પાછલ છે રે કુંડ.	
દેહ શુદ્ધિ કરી તેહમાં પેહેરી વસ્ત્ર અખંડ	૨૩
નેમને વંદન ચાલીએ જઈ ચડીએ સોપાને	
આનસંધ મેધળાએ કીયાં, આવક ચડવાને	૨૪

૧૭ વિનયવિજય તે સં. ૧૭૪૮માં સ્વર્ગસ્થ થયા, અને તેનું શરીર નય-
કાલ્યુક્ષાની અસ્તાવનામાં મેં અ.પેનાથે. તે યરોનીજયના સમકાલીન હતા.
તેજ આ લાગેછે ૧૮ અમાસથુ સમાશ્રમણુ એ નામથી ખર થતું શુરુ તથા
દેખને વંદન કરવાનું સુન. ૨૧ તદનંતર ત્યાર પણી પર્વ(સં.પ્રથા) પરમ જન્માણું
ને પાણ્યુ પાવામાટે કરેલી જગ્મા. ૨૩ દેહશુદ્ધિ રનાન-કરી શરીરને પરીત કરવું તે
૨૪ સોપાન-સીડી-પથ્યરના પગથીયાં કરાવેલાં તે. અગાઉ માવસંધ મેધળ
નામના આવકે ચડવા માટે કરાવેલા હતાં. અત્યારે આ આવક સંખ્યામાં
દેખશો “ સ્વરિત શ્રી સ ૧૬૮૩ વર્ષે કાર્તિક વદીદ સોમે શ્રી ગિરનારની
પુર્ણની માણનો હૃદ્યાર શ્રી દીરના સંવે પુરુષા નિભિત શ્રી માલતાતીષ્ઠ્રીના

ચઢતાં નેમજુ પોતમાં, એસો ચુણુનાલા,	
જર્ખ પછિમ કારે લલું દેહરો સુવિશાળા.	૨૫
માંહે આવી પ્રભુને નમો, સ્તવીએ શુભ ખોલ,	
ત્રિલુલન માંહેરે જ્યેયતાં, બહી તાહુરી સોલ	૨૬
ગણુ કલ્યાણુક તાહુરાં, હુવા માહારણ,	
દીક્ષા રાન ને મોક્ષનાં, સૂર્ય લીધા તાણ	૨૭
એ રીતે સ્તવના કરી, બુઓ સુલુ ગભારે	
પડિમા ત્રણ સોહામણી, એક ધાતુની ધાણે	૨૮
રંગમંડપને આદીએ, તિહા તેર ગિનેશા,	
ખાલી ભમતિ માંહે છે, નમીએ શુલ્વેશા,	૨૯
જિન પચાસ કદ્યા, નંદીસર દીપ,	
આવન પડિમા તેહમાં, નમી કર્મને લુપ.	૩૦
શ્રી સમેતની સાધના, તિહાં વીસ જિણુંદા	
ચાવીસ વટા દોય છે, પ્રણમી આનંદા.	૩૧
શ્રી પદમાવતી વંદીએ દોય ગાણુપતિ સપરા	
એ સહુ પાછલ જેઠને નમી નીક સાંદ્રારા.	૩૨
નેમને સનમુખ મંડપે ચૈદ સથા ખાવજા	
ગાણુધર પગલા સોહુતાં પ્રાણુમો ભવિજન્મ	૩૩
પાસે એક છે ઓરડી લેહમાં કાઉસગીયાં	
મોટા અદભૂત સુંદરાં, સુજ મન માંહે વસીયાં	૩૪
મૂલ ગભાર દક્ષિણે કારે નીકલીને	
અંધની ડેઠલ પાહુકા નેમની પ્રણમીને	૩૫

સિંધજુ મેધજુ ને ઉધાર કરાયો. ૨૫ હવે નેમનાથના ડાંટનો દરવાજો પોળ
 આવેલે ગભારા ગર્ભાગર ઇ. ૨૬ ગિનશા ગજેશ ભમતી પ્રહક્ષિણા કરવાનો: આર્થ
 ૩૦ જ્યુ જુત. ૩૩. ૧૫૫૨ ગણુધરનાં પગલાં આમાં જણ્ણાયાંછે જ્યારે
 ગિરનારમાહાત્મ્ય(રા.હોલતચંદ્પુરસોતમખરોડીઆકૃત)માંજણુવેલુંછેકબહાર
 નાઓક ઓદ્ધા પર સંવત ૧૫૮૪ ના ચૈત્ર વદિ ભીજને દિન રથાપન કરેલાં
 ગણુધરનાં ૪૩૦ જોડ પગલાંછે અનેઆ ઓદ્ધાની પથિમે સમવસરજુની ચોરસા

નેડે માતા ચક્કેસરી, દેહરી માંછે સોહે	
પાછળ દેરીરે એક છે, દોય પગલાંરે મોહે	૩૬
કુષલનાં નમી ચાલીએ પૂઠે દેરી રે એક	
રાજેમતીની પાહુકા, સંગે દેહરે નાલુક,	૩૭
ગોવર્ધન જગમાલનું, જિન કુષલસું પાંચ	
આગલ દેરી દોયમાં, દોય પગલાં રે ચાચ	૩૮
પાછળ દેહરી તેહમાં પ્રણસુ દુષલનાં પગલાં	
પ્રેમચંદ શાહે થાપીયા આવક નમે સંઘલા	૩૯
નેમની પાછળ લોંચરે અમિતર જિન પાસ,	
સંગે પડિમા દોય છે નમતાં શિવ તાસ	૪૦
ઉપર જીવીત સ્વામીની સુરતિ સુખકારી	
થીલુ રહુનેમી તણી, સુરત છે રે ઘારી	૪૧
સુલ કોટની દેહરી, ચોરાસીરે ધારી	
નેડુ જિનને વંદીએ, એ છે લવજલ તારી	૪૨
નેમથી પુર્વ દિશા અ છે, દિગંબર લવને	
પડિમાં એક બુહારીએ તેહ નીરાયો સુમને	૪૩
માંડવીવાલો ગુલાખસા તેણે કુંડ બનાયો	
અંધની છાયા હેઠલે, ભવીજિન મન લાયો	૪૪

રચનાનો ઓટલોછે તેમાં પણ ૪૨૦ પગલાંની જોડછે. ૩૮. ગોવર્ધન જગ.
માળ ગિ.મ.માં લખ્યુંછે કે નેમીનાથના દેવાલયનો ઉદ્ઘાર સં. ૬૦૬માં રતનશા
આવક કર્યો તેથી હાથ તેને રતનશા ઓસવાળનું દેદુંકહેછે તેની પણવાકે પો-
રેનાડ જગમાલ ગોરખનવાળું પુર્વ દારતું દેહંછે તેમાં પ પ્રતિમાછે. મુળનાથક
અંદીશ્રરણ છે “ચાચ સારા. ડટ પ્રેમચંદ શાહ-રોડપ્રેમાલાઈ હેમાલાધ લા-
ગેછે કન્ચે સગરામ સોની ની ટુક આશરે ૧૮૪૩માં સમરાવીછે ૪૦ અમિતરા
અમૃતજ્યેં ટીપાં જરતાં હોય તેવા ૪૧ સુરત મુર્તી મુળ. ૪૩ દીગંબર લ-
વન દીગંબર દેહરે. આમાં એક મુર્તિછે તે વંદીએ અને આનંદિત મનથી
નીરાયીએ એમ કંધી ખેતાંબર હોધ જણાવેછે. આપરથી કવિની અને તેસમ-

વસ્ત પાલને દેહરે, તિહાં ચોમુખ થાયો	
તેજપાલનાં દોય છે, દેહરા જસ વ્યાપ્યો	૪૫
એક દેહરે જિન એક છે, બીજે ચોમુખ સારો	
પાછલ માંડવી શહેરનો સાહ ગુલાબ વિચારો	૪૬
તેણું દેવલ ખાંધીઓ, તિહાં એક જુહારો	
નોડ સંપ્રતિ રાયનો દેહરો નીરધારો	૪૭.
તેહમા નેમિ જિણુંદળ, સુજ લાગે ખારો	
પાછળ ઝાનરે વાવ છે, જલ અતિ સુખડારો	૪૮
પદમ દ્રહની ઉપમાં, પદ પંક્તિ સંલારો,	
લીમકુંડ સોહામણો, ધન અરદ્યું અપારો,	૪૯
લીમળ પાંડવે તે કીઓ, મનમાંહે વીચારો	
ઉપર કુંમારપાલનોં, સુનો દેહલ સધારો સુધારો	૫૦
નેમ જિનેશ્વર ચૈત્યથી, ઓમરદાસ વાડું	
દેહરે અદ્ભૂત સ્વામી છે, પ્રણુસું ત્રણ વાડું	૫૧

યની દીગં અરશેતં અર કંચે સમતા જોવામાં આવેલે. ૪૫ વસ્તુપાલ તેજપાલ બંને ગુજરાતના વીરન્દવલ રાજના મંત્રીઓ વસ્તુપાલ સં. ૧૨૮૮માં અને તેજપાલ સં. ૧૩૦૮માં સ્વર્ગશ્ય થયા તેટલા લેખો ગીરનારપરનામાટે જુઓ મુની શ્રી જિનવીજ્ય કૃત જૈન પ્રાચીન લેખ સ મહ ભાગ ૨ જો.સ. ૧૨૮૮ માં નિરનાર પર દેહરાયન્ય ચોમુખ-ચારે દીથા તરફના મુખવાળી ચાર પ્રતીમાઓ છુજારો વાદી સંપ્રતી રાજ વીશતત્રણુસેં માં જિનજયિતીના રાજ પ્રસિધ્ધ ચૈપન્સ સાઓદ અશોકના પુત્ર કુઞ્ચિકઠો પુત્ર. ૫૦-કુમારપાલ-સને ૧૧૪૩-૧૧૭૪ સુધી ગુર્જરનો પ્રસિધ્ધ પરમાહૂતે રાજ-હેમાચાર્યના શિષ્ય તેમણે અંધાવેલ દેહરું કરીના સમયમાં શુન્ય હતું તેથી તે સુધારો એવી ભલામણું કરેલે. ૧૩-છળથા-માગરોળના શેઠ ધરમશી લેમચંહે સમરાંયુછે. જી.મ.) ૫૧-ઓમરદાસ વાર-(?) બાનેખદલે એતાર દશવારું. હોલું જોઈએ એટલે ઉત્તર દીશા તરફ સુંદર એવું. અદ્ભૂત સ્વામી હાલ અદ્યથ સ્વામી-કહેલે. તે ઇપલેવ જુની મુર્તિછે. તેમાં ઇથાનું ચિન્હછે તથા અલાદિપર કાઉસગીઓછે આ મુર્તિને અન્યમતના દોડ બીજના પુત્ર બટોરકાં [ધડી ખડુકોં] કહેલે. વખતશાહ તેણાં

તીહાં આરસમઈ કોરણી, માણ ચોવીસે વદ્દો	
બખત સાંડે તે કુચો, તુમ જુબો પ્રગટ	૫૨
તેહને સન્મુખ હેહર પદમ ચ હેરે કીધું	
પંચમેર્દી કરી થાપના, સવિકારજ સીધું	૫૩
વીસ જિણેસર તેહમાં બેઠા મહારાજા	
તેહને જમણી પાસ છે, વળુથદી સંઘ તાજા.	૫૪
તેહનાં હેહર માણ છે, અહુ થંલ સોહાવે.	
અનુપમ કોરણીએ કરી નોઈ સીસ ધુણાવે	૫૫
સહેસકથા પ્રભુ પાસણ, તેહમાં કાનદાસે,	
થાયા દોય જિણુંદળ, તુમ જુચો ઉલ્લાસે	૫૬
પાછળ જમતી દેહરીઓ, કહી અહતાતીસ,	
તિહાં સુહુંકર સાહિણા, જિન પિસતાવીસ	૫૭
પ્રભુજીને જમણું નોઈએ, અણાપદ દેરું	
ચ્યાર આઠ દસ દોયાં ને, હું પ્રભુસું સવેરું	૫૮
જિનની ડાણી વિસાલહું હેહરે ચોમુખ વારું	
ચ્યાર જિનેસર તેહમાં નિત ઉઠી નોહારું	૫૯
દાંઅમ સોનીને હેહરે, કોરણીની જુગત,	
માટો મંડપ મંડીઓ, કેતી કહું વિગત	૬૦

તિદાસુન નમરણેઠના લાભેછે. (જુચો તેના ચરીનભાઈ મારું પુરતક જેનચેયે તથા સિક રાસમાળા-ભાગાલે.) ૫૩-૫૮મંચ્યદ-તે કદાય ઉદ્યન માત્રીનો પોત્ર પદસિદ્ધુંકે જે સં. ૧૩૦૫ પહેલાં થોડો રે હેણ્ય. ૫૬. કાનદાસ? -નેઅદ્યે કાશાદાસ નોઈએ કારણુંકે રીળાસેખમાં જાણુંયું છોડ સર. ૧૮૫૬ અમદાવાદ વીસા શ્રીમાણીશા વલ્લકા શાખાના રમ કંદરણ શુલ સા. કાર્યાદાસેવ રૂપશ્ચ અર્થશ્રી ગિરનારણ તીર્થે શ્રી સાહેબ કૃષ્ણ પાંચનાથ બિંબ કારાવિત શ્રી દિવિલય જિનેદ્દસુરિભિઃ અતિષ્ઠિતઃ. ૫૭ સુહુંકર-સુપસુકર, દુલ્લાદરનાર. ૫૮ સરેણ-સરેણ-મુદ્દા-૬૦. કેંઅમસોની-અકારાદોદ્ધાહના સમપમાં ખરણમાં થપા. તેને અકારા ગાદસાદ મામેઃકુહી મોખાવના એમ કેદેનાય તે. તેની - કદરી.

તેહમા સહેલશ્વરા પ્રભુ એક છે મહારાજ પાછળ જોધપુરી લડો અમચંહ છે તાજા.	૬૧
તેહને દેહરે એક છે જિનજુ સુખકારા	૬૨
તેહથી ઉત્તર દેહરે જિન એક સુધારા	૬૩
પાછળ ગજપદ કુંડ છે જુઓ દણ નીહાલી	૬૪
તિહાં જિન પડિમા એક છે, કુંડને થંલ લાલી	૬૫
આગલ કેકી કુંડછે, મેં નયણે રે નિરખ્યો.	૬૬
ગિરિથાનક સહૂ નિરખતાં બહૂ આતમ હરખ્યો.	૬૭
મેલગ વસહીએ સોલ છે જિન મંહિર મોટાં	૬૮
એકસો બત્તીસ મેં ગણ્યા દેહરા સવિ છોટા	૬૯
સર્વ લલી દેહરા દેહરી, એકસો અહતાલીસ	૭૦
તેહમાં પ્રભુજી ચારસે ઉપર વલી ખત્રીશ	૭૧
નેમને વંદી ચાલીએ સહસા વન જઈએ	૭૨
વાસ્તુપાલનાં દેહરાં, પાછલ થઈ વહીએ.	૭૩
ઉપર ચઢતાં દક્ષણે રાજુમતી ગુદ્ધાઈ	
ચેસી રાજુમતી વંદીએ, રહનેમી ઉધાડ	૭૪
વંદી આગલ ચાલીએ આવી ગોમુખી ગંગા	૭૫
તિહાં ચોવીસ જિણુંદના, પગલાં સુખસંગા	૭૬
પણુંભી આગલ ચાલતાં, આવ્યો કુંકાપાત	૭૭
તે થાનક દો દેહરી સુંદર વિખ્યાત	૭૮
તિહાં પગલાં રામાનદના જોડી લેમાનંદી	૭૯
આગલ દુઃખરદાસનાં પગલાં સહૂ ઝંડી	૮૦
હગલાં ભરતાં પ્રાણિયા આવી હાથીપોળ	૮૧
તિહાં ચેસીને જાતરો, સહેસાવન જોલ	૮૨

૬૧જોધપુરી અમીચંદ કોણુહતા ને ક્યારે થયા તે અમને જણ્ણાઓ નથી, ૬૫
મેલેંગ વસહી—મેલકકાલ નામે રોઠ થયા તેની વસતી—કુંડ. ૭૦ કંદાપાત
—નેરવ જ્ય (નેરવ જંય) —તે ઉપર અઢીને અસલના વખતમાં દુઃખી
મોડો પરબ્રહ્માં સુખ પામનાની આશાએ જંગાપાતકરી માણું એપ્તા.

મારગ વિકટ જાડી બાંદુ, ઉત્તર એ જખ હેઠે.

હેરીએં નેમની પાંદડા નમતાં હુઅ નેઢે	૭૩
તે થાનક પ્રભુ નેમને, સંજમ તેવલનાણુ	૭૪
રૂજેમતી પણુ તેહીજ થાનિક શિવઠાણુ	૭૫
તે કારણુ ભવી પ્રાણીઓ, પૂજે પ્રભુજીનાં પગલાં	૭૫
કેસર ચંદ્રન લેછને, જિમ હુઅ જાએ સંગ્રહા	૭૬
ગીત નૃત્ય ખનાવીને, પ્રણમી પાણ ચાલો	૭૬
ગોમુખી જાંગા આવીને, બીજુ દુંક સંભાલેદુ	૭૭
રાજરામે બંધાવીઓ, પગભીઓં સોહુતાં,	૭૭
જમણુ રહનેમી તણુ, દેહરુ સુણ સંતા	૭૮
સોપાને ચઢી ચાલતા, આંદ્રા માતાણ આંદ્રા	૭૮
અનોપમ ઝેરણીએ કરી, દેહરે ઘણુ થંભા	૭૯
બાહુન સિંહને ઉપરે, બેઠા છેરે આંદ્રા	૭૯
મિથ્યાત્મી કલે માહરા એહ છે, જગદંબા	૮૦
તે એટું કરી માનીએ, સહી શાસન અકિલ	૮૦
નેમની એ અધિષ્ઠાધકા, કંઈ થાસમાં બુગતિ	૮૦
તે આંદ્રા પ્રષ્ટમી કરી, નીકસો જવધારે	૮૧
શિંહની મુરત દીપતી, કોઈ ચાલ વિચારે	૮૧
નીજુ દુંક જર્દ કરી નેમના પય વંદો	૮૨
કેરણીએં શોભતી, દેહરી બેઈ આનદ્રો	૮૨
મિથ્યાવી કલે એહ છે, ગોરખનાયના પગલાં	૮૩
ચોથી દુંક ભણી ધરો, ભવીયણુ તુમ ઉગેલાં	૮૩

૭૩નેઢે-નાશપામે.૭૪સંજમ-સંચમ-દીક્ષાશિવઠાણુ-નિર્વાણ. ૭૫રાજરામકેશુ
હતાનેકપારે થયા તે અમોને જણાયું નથી. તેમણે પનથીર્યા બંધાબ્યાં હર્તા, ૭૬
અંભા-તે જેનો પ્રમાણે નેમિનાયળુની અધિષ્ઠાબિકા હેવીછે. તેને જેનેતરો પણ
ફૂનેદ્ર-માનેછે-૮૩ નેમિનાયળાં પગલાં સેને જેનો કદેછે. તેને જેંજેતરો ગોરખ-

તિહાં પણ નેમની પાડકા, વલી સુંહર પડિમા	
ગોસાંઈ ઉધડનાથના, જાયગા કહે ક્ષણુમાં	૮૪
ગોસાંઈ વેરાગીયાં, કરે નવ નવ સેવા	
તિહાંથી ચાલતાં હેઠલે, જાણે તત્ત્વેવા	૮૫
ન્યાસની કુમાર અતિતત્તું, થાનક છે દે રૂકું	
કુંડ કુમંદલ હેઠલેં, નહીં આખ્યું કુંડું.	૮૬
તેહને ઉપર ચાલતાં, આવી પાંચમી દુંક	
વિષમથલે ચલતાં થકાં, નેમ પગલાને દુંક.	૮૭
કુસર ચંદન લેધને પગલાને પૂજો	
પડિમા એક છે ઓદીયો, એહ દેવ ન હુંનો.	૮૮
નેમ થયા તે થાનકે, શિવનાં અધિકારી,	
મરમી જન લેલા મળી, વંદે નરનારી.	૮૯
આવક કહે પ્રભુ નેમની, એહીજ પડિમા છે	
આખ્ય સંકરાચાર્યની, ચરાવે છે આ છે.	૯૦

નાથનાં પગલાં હદેણે. ૮૪ જાયગા-જગ્યા ૮૫ અતિત - [સ. અતિતથ]
કુરતો સાધુ-આવો-નીખાં. ૮૬ પાંચમી કુંડમાં પણ નેમનાં પગલાં છે. ત્યાં
જવાનો માર્ગ ધરો. વિષમ વિકટછે જરા ચુંધ્યાતો ખાદ્યમાં પડી ચુરો
થવાના ત્યાં નોમનાથ નિવીંખ્ય પાંચા એમ 'કડેવાય' છે ત્યાં નેમની
પ્રતીમાણે તેને ખાલણો. શંકરાચાર્યની છે એમ હુંદેછે એમકાંઈ કહે છે.
હમણાં વૈષ્ણવ લોક ત્યાંના જે પગલાછે તેને ગુરુદાત્તાત્ર્યનાં પગલાં કહેછે અને
શુસ્તખમોન મદદરાપીરનો તક્કીયો કહેછે. આરથાને નેમીનાથન પ્રથમ અખુખર
જાહેર મુનીનું નીર્બાધ થયું હતું. ઓનામભાંધા સંભવતં કંઘ્યુસોણે ચુશ્ચત
'નીમ લંબોડાય' લાગેછે. ઓનાનભાં અનેક ધર્માત્મી પુન્યતા ધર્યી કુરુદા
નંનકાણે 'ખીન' તીર્થોપર આકું 'જગ્યા'પણે, તેપરણી એવું અનુમાન કરતાને

એ પગલાં જિન નેમનાં, કહી શાધ ઠરાવે	
દત્તાત્રીની પાહુકા, ગોસાંધ ઘનાવે	૬૧
ને જેહનાં મનમા વસ્યું, તે તે ઠહરાવે	
આગાલ પંથે ચાલતાં, રૈણુંકા માત આવે.	૬૨
પાડવ પાંચ શુક્ર ભવી. નોઈ આગાલ નિરખો	
છી દુંકેરે કાલિકા, હેઠી મન હરપો	૬૩
ચાલતાં આગાલ આવીયા વાધેસરી માતા	
સાતમી દુડ સોણામણુ; જુઓ નજરેણતાં.	૬૪
તિણાં રસ કુંધીનો કુંઢે, રૂપ સોના સિદ્ધિ	
રયણુની મડિમા એક છે, નિસુણી અહુ ભુદ્ધિ.	૬૫
ત્રીજે ભવે ને મોક્ષમાં, જનો રે પ્રાણી	
તે ભવીમણુ નિત વંદસે, કહી શાસ્ત્ર પ્રમાણુ.	૬૬
ત્યાંથી પાછાં ઝરી આવીને, પ્રલુ નેમ જ્ઞાહારો	
નાટિક પૂળ ધૂપથી, કરિ જનમ સધારો.	૬૭
નેમની પોલથી બાહિરે, લાખા વન સારું	
રેવતા ચયનાં ઠાંણુ છે, નોઈ આતમ તારો.	૬૮
ઇત્યાદિક ગિરનારનાં, અહુ ઠાંણુ અનેરાં	
છે પણ જેઠણું ભાલીઓ, તેતણું ઠહાં સારો.	૬૯

સાધન કારણુ છે કે ને રથાન ધખુા મહીમાવાળું પ્રસીધ થાયછે તેપર સમયની અતુકુલતાએ પ્રાય: સર્વ ધર્મ પોત મેતાતું આસન જમાવેલે અને કટલોક સમય જતાં તેતું મોકું મહાત્મ્ય પણું ર્યાનિનાખેલે”-જૈનહિતૈથી ચૈત્ર વેદાખ વીધિત ૨૪૩૮. ૮૮ આલીએ-આળીઆમાં-ગોભધામાં-૬૨ રેણુકા-છફીદુંડ . -તેને રેણુકા થીભર કહેલે. હાલમા જ્યારે કાલીકાનીદુંદને સાતમી દુંડ કહેલે.

ભાગ્ય નિજરે જોઈને, તે સહી કરી માનો	
સધલાં તીર્થનો નાયક, ગિરનાર વખતો-	૧૦૦
શ્રી ગિરનાર ગિરિ તળી, કહી તીર્થ માલા	
નેમનાં ત્રણ કલ્યાણુક, જીવતાં જાયમાલા.	૧૦૧

૫ ૭ ૯

સંવત અગનિ સાગરે, કરટી ચંદ્રને અદો	
તાપસ માસને ઉજદે, રસને માંડે અદો.	૧૦૨
સુર શુરૂ બાસરે જાણુંએ, શુરૂ વિવેક પસાયા	
ન્યાયમાખર કહે પૂન્યધી, નેમનાં શુષુ ગાયા-	૧૦૩.

પણ આ કાગળમાં કાંઠીકાની દુંડુંને છી ગણેલીછે, ને રેણુકા માતની ને જુદી દુંડું ગણીનથી નેવાયેસ રીમાતાની સાનગી દુંડું ગણીછે. ૧૦૨-કરદી (સાં કરદીન)-લાયા. અંદ અંરાત હાથી ગણુંએછે તેથા ૮ સંપ્રયા કુચવેછે. તાપસના માસ માદ્ય માસ



પ્રભાતીયું,

ન્યાં લગી દેશાહિં રહ્યો ત્યો જહિ,

ત્યાં લગી સંપત્તિ સર્વ જુહી;

લાખને કોડથી વિત સંગ્રહ કરો,

જાણુને એ અધું રામ મૃહી.

શું થયું માલ પરદેશને લાવીને,

એકના ચ્યાળણા દામ લીધે;

શું થયું માલ કાચો ભરી સ્ટીમરો,

મોકલી લક્ષ્મા લાખ લીધે.

શું થયું ખૂબ ભાગી ઉંચી ડીઢી થકી,

શું થયું માન ધંડાખ લીધે;

શું થયું કોટ ને હુંઠ ધાર્યા થકી,

શું થયું શાનજલ પાન કીધે.

શું થયું ઉકાળીને ખૂબ ભાખણું વહે,

શું થયું રાગને રંગ જીવણું;

શું થયું દેશ પરદેશ સેવ્યા થકી,

શું થયું વરાણના લોડ જાણો.

એ એ વ્યવહાર સહું પેટ કારવા તણું

દેશનું હિત તેમાં ન જોશો;

દેશના હિતનાં તરવ દર્શન વિના,

રત્ન ચિંતામણી જન્મ એશો.

૫

(મેળવેલું)

ગુજરાતનાર ની ગોત્રી અહા ! અહલક જગાવાદે ?

ગાજુલ

મહુને ખસ છોડ ઓ માયા ! હુંચે વનવાસ જંવા હે !
 ગુજરાતનારની ગોત્રી અહા ! અહલક જગાવા હે !
 તળ સંસાર કૃળ ખાટું મધુર કૃળ માણ ખાવા હે !
 હરીના નામની હરદમાં લખિત ધુનતો લગાવા હે !
 સગાંના રનેહુને છોડી. પ્રલુધી પ્રીત થાવા હે !
 શરીરે ભસ્તમ ચોળીને. હુંચે ધુણી ધખાવા હે !
 અરે ! સંસારછે ચોટો. છતાં ફૈંકટ કુસાવા હે !
 જુઠી જંબળને છોડી. હરીના ગુણુ ગાવા હે !
 અહા નિષ્ઠ રહાથી અરતાં. અરણ જલમાંજ નહાવા હે !
 મીઠા કૃળપુલ વૃક્ષેથી. સ્વહુસ્તે લેઈ ખાવા હે !
 તળ પરતંત્રની બેડી. સ્વતંત્ર સદાય થાવા હે !
 વહે શંકર વિલૂના. નામની ખાસી બનેવા હે !

“મણીકોન્ત.”

(કાવ્ય માળામાંથી.)

યાદીતાણું ધી અંહાદુરસિંહલું પ્રી. પ્રેસમાં
 શા અમરચંદ બહેયરહાંસે ધાખું

નામદાર મુખ્ય સરકારનાં કેળવણી ખાતા તરફથી,
મહિલા મહોદય અંથ માટે મળેલ મંજુરી પત્ર.

નં. ૫૧૦ ઓઝ ૧૯૧૬-૨૦

એમારીન ઓઝ ધી એન્યુકેશનલ ઈન્સપેક્ટર, ગોર્ડ ડિવિઝન,
અમદાવાદ તા. ૧૦ એપ્રીલ. ૧૯૧૬

ધી એન્યુકેશનલ ઈન્સપેક્ટર (ઉત્તર વિભાગ)

કૃ. હુરખચંદ ઉજમશી એસ્કવાયર.

દેંઠ ઘણાઉદ્દિન ર્સેટ—જુનાગઢ.

સાહેબ,

નામદાર ઈરેક્ટર સાહેબ ઓઝ પણ્ણીક ઈન્સક્શનને આપ્યો
તા. ૧ લીન્ન જુલાઈ ૧૯૧૮ ને રોજ જે કાગળ લખ્યો છે તેના
જવાબમાં મારે આપને જણાવવું જોઈએ કે, મુની ખાતવિજયલ
કૃત “મહિલા મહોદય” નામનું પુસ્તક જે સાચનગર મધેના
આથુંદ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈ અને શેડ હેવચંદસાઈ દામલ
કુંડાકર તરફથી પ્રસિદ્ધ થઈ અને જેની ૧૯૧૮ ની સાલની
આવૃત્તિની કિમત ૧-૪-૦ છે. ડિવિઝન ગુજરાત ખુક કમીશીના
મેળદાની ભલામણ ઉપરથી એ પુસ્તક મુખ્ય ધીલાકાની પ્રાથમિક
અને સેકન્ડરી સ્કુલની અને ટ્રેનિંગ ક્લાસેજની લાયઙ્ગ્રેડી માટે
મંજુર થઈ છે. આ બાબતની જાહેરઅભસર ચોથ્ય વર્ષે. “ગુજ-
રાત શાળા પત્રમાં” અને “ઇન્ડિયન એન્યુકેશન” માં આપવામાં
આવશે. આથી સૂચવામાં આવે છે કે.



હવે પછી આ પુસ્તકની નવી સુધારેલ
માટ્લાર પડે ત્યારે એક ઓપી ફરી મંબુરી માટ્લા
ને ઉપરથી એ પુસ્તકો નિશાળોમાં અપાય તે માટ વાયુ દૂર
માન ડાઢવામાં આવે.

મને માન છે.

સાહેબ,

આપનો તાંગેરીર સેવક થઈ રહેવામાં
(રે) એ. એમ. હિવાનાણ.

પરસનલ આસીસ્ટાન્ટ ઈ. આઇ. એન. ડી.
ફાદ. એન્સ્યુકેશનલ કન્સેપ્ટર એન. ડી.

